https://archive.org/details/bk109/page/n0/mode/1up

1995-05 -Satpanth Jyot (109)

All Items on https://archive.org/details/realpatidar

Full Library on https://realpatidar.com/library

સતપંથ જ્યોત

વર્ષ : ૨
અંક : ૭
સળંગ અંક : ૧૯

મે
૧૯૯૫

: પ્રકાશક :
સતપંથ પ્રકાશન સમિતિ
શ્રી સતપંથ પ્રેરણાપીઠ, પીરાણા–૩૮૨૪૨૫
તા. દસક્રોઈ, જિ. અમદાવાદ.

realpatidar.com

https://archive.org/details/bk109/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

Real Patidar
Unravel Truth

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

No specific pages. See whole book.
References by: RealPatidar.com

https://archive.org/details/bk109/page/n2/mode/1up

1995-05 -Satpanth Jyot (109)

realpatidar.com

સતપંથ જ્યોત

વર્ષ : ૨

અંક : ૭

સળંગ અંક : ૧૯

મે

૧૯૯૫

: પ્રકાશક :

સતપંથ પ્રકાશન સમિતિ

શ્રી સતપંથ પ્રેરણાપીઠ, પીરાણા–૩૮૨૪૨૫

તા. દસક્રોઈ, જિ. અમદાવાદ.

realpatidar.com

realpatidar.com

* પ્રાર્થના એટલે શું ! *

પ્રાર્થનામાં છુપાયેલી શક્તિનો અનુભવ દરેક કાળમાં દરેક જાતિ અને ધર્મના લોકોએ કર્યો છે.!! આ કારણે જ પ્રત્યેક ધર્મ અને સંપ્રદાયમાં પ્રાર્થનાનું મહત્વપૂર્ણ વિધાન કરવામાં આવેલું છે. પ્રાર્થનાની ભાષા-રીત જુદી જુદી હોઇ શકે છે. પરંતુ તેનો પ્રભુ પ્રત્યેનો ભાવ તો હંમેશા એક જ હોય છે !!

બ્રહ્માંડની સર્વોચ્ચ સત્તા અથવા ઇશ્વર પ્રતિ સંપૂર્ણ સમર્પણ અને કલ્યાણની યાચના એજ હંમેશા પ્રાર્થનાનો ભાવ હોય છે. આમ છતાં કદીક પોતાના તો કદીક અન્યના કે આત્મીયજનના કલ્યાણ માટે પણ પ્રાર્થના કરીએ છીએ !! મહાત્મા ગાંધી પ્રાર્થનાને આત્મ-શુધ્ધિનું આહ્વાન, વિનમ્રતાનું પ્રતિક અને પશ્ચાતાપનું પગલું માનતા હતા. તેઓ કહેતા પ્રાર્થના આપણને વધારે શુદ્ધ બનવાની આતુરતા સુચવે છે" તેમણે લખ્યું છે કે "પ્રાર્થના વિના હું ક્યારનોય પાગલ થઇ ગયો હોત." પ્રાર્થના આપણને શક્તિ આપે છે. વિવેક અને વિનમ્રતા બક્ષે છે. પ્રાર્થના આપણને અસતમાંથી સત્ તરફ લઇ જાય છે. અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે. મૃત્યુમાંથી અમરત્વ તરફ લઈ જાય છે. તે જીવાત્માને પરમાત્મા તરફ ઉર્ધ્વન કરાવે છે. પ્રાર્થના સૃજિત અને સર્જક વચ્ચેનો સંવાદ છે.

(સંકલન જી. કે. પટેલ, વજેપુરા S.K.)

વાર્ષિક લવાજમ	: ભારતમાં રૂા. ૪૨/-	વિદેશમાં	: રૂા. ૧૮૫/-
આજીવન ગ્રાહક	: ભારતમાં રૂા. ૪૫૧/-	વિદેશમાં	: રૂા. ૧૪૦૦/-
અમર ગ્રાહક	: ભારતમાં રૂા. ૧૦૦૧/-	વિદેશમાં	: રૂા. ૩૦૦૧/-

છુટક નકલ રૂા. ૪/-

• સતપંથ જ્યોત દર મહિનાની દશ તારીખે પ્રગટ થશે. • ગ્રાહકે પોતાના સરનામામાં ફેરફાર કરવાનો હોય તો નીચેના સરનામે પત્રથી જાણ કરશો. • પત્ર વ્યવહાર કરતી વખતે પોતાનો ગ્રાહક નંબર અવશ્ય જણાવશો. • ગમે તે માસથી ગ્રાહક થઈ શકાય છે. • પોતાના ગામના અંકોના વિતરણ કાર્યમાં સેવા આપનાર વ્યક્તિએ પોતાનું નામ અને સરનામું જણાવવું.

પત્રવ્યવહાર તથા લવાજમનું સરનામું :-સતપંથ પ્રકાશન સમિતિ
સતપંથ પ્રેરણાપીઠ, પીરાણા, તા. દસક્રોઈ જિ. અમદાવાદ 382425
ટેલીફોન STD | 02718-88-227
02718-88-229
સંપાદક :- શ્રી સામજીભાઈ કે. પટેલ

મુદ્રક : નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ, ઘીકાંટા રોડ, અમદાવાદ-૧. ટે. નં. ૩૬૩૬૩૧

realpatidar.com

https://archive.org/details/bk109/page/n4/mode/1up

1995-05 -Satpanth Jyot (109)

realpatidar.com

સતપંથ સંપ્રદાયનું ધાર્મિક પ્રેરણા આપતું માસિક

સતપંથ-જ્યોત

[માસિક]

વર્ષ ૨]   અંક ૭   *   મે-૧૯૯૫   *   [સળંગ અંક ૧૯

— લેખકોને વિનંતી —

સતપંથ જ્યોત, સતપંથ સંપ્રદાયની માસિક પત્રિકા છે. તેમાં સંપ્રદાયને તથા સર્વોપયોગી થાય તેવી મુખ્યત્વે વાર્તા, લેખ, જીવન વૃત્તાંત, કાવ્ય, ભજન વગેરે કૃતિઓ પ્રગટ થાય છે. જે સાદી-સરળ ભાષામાં આલેખાયેલી હોવી જોઈએ.

અન્યત્ર પ્રગટ થઈ ગયેલી કે, કોઈ પત્ર-પત્રિકામાં છપાયેલી કૃતિઓ સ્વીકારવામાં આવશે નહીં.

કૃતિઓ ફુલસ્કેપ કાગળ ઉપર એક જ બાજુએ સારા અક્ષરે લખાયેલી હોવી જોઈએ. લખાણની તમામ જવાબદારી લેખકની રહે છે. પોસ્ટ કાર્ડ કે અંતરદેશીય પત્ર પર લખેલા લેખ રદ બાતલ ગણાશે.

પોતાનો લેખ અંકમાં ફરજિયાત પ્રગટ થાય તેવો આગ્રહ રાખવો નહીં.

સતપંથ જ્યોતમાં પ્રગટ થતા બધા લેખો સાથે સંપાદક હંમેશાં સહમત છે તેમ માનવું નહિ. લેખ પ્રસિદ્ધ કરવો કે નહિ, તે સંપાદકને આધિન છે.

—સંપાદક

આપણા બાળકો શીબીરોમાંથી સુસંસ્કારો લઈને ઘેર આવ્યા પછી નિયમિત અમલ કરે છે કે કેમ તેનું શીબીરાર્થી-ઓના માતા-પિતાએ કાળજી રાખવી જોઈએ. નાના બાળકોને જેવી ટેવ પાડીશું તેવી ટેવ પડશે. તેમાં શંકાને કોઈ સ્થાન નથી કારણ કે આપણા બાળકોને આપણે જ ગુજરાતી ભાષા બોલવાની ટેવ પાડીએ છીએ. અને ગુજરાતી બોલતાં શીખી પણ જાય છે તેમજ દક્ષીણના લોકો તેમના બાળકોને અંગ્રેજી શીખવાડે છે. અને બાળકો અંગ્રેજી ભાષા શીખી પણ જાય છે આમ અનેક જુદી જુદી જાતીના મા બાપ તેમના બાળકોને જુદી જુદી ભાષાઓ નાનપણથી શીખવે છે. અને શીખી જાય છે. તેમ આપણે આપણા બાળકોને જેવી ટેવ પાડીશું તેવી પડશે. તો આજથી જ શિક્ષણ અને સુસંસ્કારનું સિંચન કરવાનું શરૂ કરીએ. જેથી બાળકોને તેમજ માતા પિતા અને કુટુમ્બને ઉપયોગી થાય તે આજના કલીકાળમાં બહુ જ જરૂરી છે.

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk109/page/n5/mode/1up

realpatidar.com

* મન-ચિંતામણી પુસ્તકમાંથી *

[શ્રી ઈમામશાહ મહારાજ રચિત]

(ગતાંકથી ચાલુ)

ધમિયું સોનું વહી કરી જાય,
મુનિવર અંતરમાં કોઈ ના પાયે.... (૧)
સદ્દગુરુ જ્ઞાનનો ભેદ જ લઈએ,
કરમ ફળને વળગી ના રહીએ .... (૨)
ભેદ ના જાણે સદ્દગુરુનો સાર,
ખર પર ચંદન વહે જેમ ભાર ... (૩)
આહાર નિંદ્રા ને ભય મૈથુન,
સર્વે દેહને જાણો સરખાજન .... (૪)
મનુષ્ય દેહોને અદકું જ્ઞાન,
જ્ઞાન નહીં તે પશુ સમાન .... (૫)

તુંહી સાચા સાહેબ હો...
જ્ઞાન સમજે મુનિવરો,
થર કરવાને મન
થર મને મુક્તિ ફળ મળે,
એમ જાણો મુનિ જન. (૩૩)

એવું જાણીને જે ચેત્યા જન,
બ્રહ્મજ્ઞાન વિના ન છૂટે કરમ .... (૧)
મુનિવર અંતરમાં રાખી રહીએ,
વાદ-વિવાદ વિષય સર્વ તજીએ.... (૨)
મુનિવર સર્વેને હેતે લઈએ,
મન ચિત સર્વ ગુરુનર ચરણે દઈએ. (૩)
મન માંહેથી જે મમતા તજીયે,
તો ઘટ માંહે બ્રહ્મ જ્ઞાન નીરખીયે.... (૪)
જ્યાં લગી મમતાએ હું હું કરશે,
ત્યાં લગી કાયા કલેશ ભોગવશે (૫)

તુંહી સાચા સાહેબ હો....
કાયા કલેશ ના કીજીયે,
નિર્મળ કીજીયે દેહ,
વાસના સર્વ છોડીએ,
એ જ સર્જનહાર સાથે નેહ. (૩૪)

ક્રમશઃ આવતા અંકે

realpatidar.com

https://archive.org/details/bk109/page/n6/mode/1up

realpatidar.com

✱ સદ્‌ગુરૂ શ્રી ઈમામશાહ મહારાજ જીવન વૃત્તાંતમાંથી ✱

(ગતાંકથી ચાલુ)

મૃત્યુદેવતા છે. તે પોતાની બંને બાજુએ રહેલા સંસારરૂપી વાસણમાં પ્રાણીમાત્ર રૂપી દાણા મુઠી મુઠી લઈ ઘંટીમાં નાંખે છે અને આ સંસારરૂપી ઘંટી એક સરખી ફર્યા કરે છે. દરેક દાણો-પ્રાણીઓ તેમાં મૂકાય છે અને નાશ પામે છે. આ વિનાશકારી ઘંટીમાંથી બચવું હોય તો એ ઘંટીમાં જ કોઈ નિર્ભય સ્થાન આપણે ખોળવું જોઈએ. જે દાણા ઘંટીના ખીલાના આશ્રયે રહે છે તે ભરડાતા નથી. તેમણે રક્ષણ મળે છે. તેથી આપણને કાળના કરાલ મુખ-માંથી બચવું હોય તો આ સંસારરૂપી ઘંટીના પરબ્રહ્મરૂપી અવિનાશી ખીલાનો-પરમેશ્વરનો આશ્રય લેવો. તેની ભક્તિ કરો, તન, મન, ધન, તેને અર્પણ કરો અને દરેક રીતે તેના જ થઈને રહો. એ પ્રમાણે કરશો તો તમારા ઉપર પરમેશ્વરની કૃપા થશે પછી કાળની બીક રહેશે નહીં શ્રુતિ કહે છે–

आनन्दं ब्रह्मणो विद्वान् न बिभेति कदाचन ।

જે પરબ્રહ્મના આનંદમય સ્વરૂપને ઓળખે છે તે કદાપિ ડરતો નથી, એ જ ખરેખર જીવ્યો કહેવાય અને તેને જ મુક્તિ મળે. તેથી આ અપાર મોહમાયાની જાળમાં નહીં ફસાતા સતત જાગૃત રહેવું જોઈએ. જે જાગૃત રહેતો નથી અને અભિમાની હોય છે તે સર્વવ્યાપી પરમેશ્વરને ઓળખી શકશે નહીં. મોહપાશ તોડવા માટે વેદ અને શાસ્ત્રોમાં કહેલા નિયમોનું પાલન કરવું જોઈએ. યુગગુરુ મહારાજ કહે છે–'વેદશાસ્ત્ર કહે તે કરવું રે ભાઈ' વેદશાસ્ત્રના નિયમોનું પાલન કરો. પણ અંધશ્રદ્ધા રાખતા નહીં. યોગ્ય અને સત્ય હોય તેવું આચરણ કરો. રોજના વ્યવહારમાં સામાન્યતઃ શી રીતે વર્તવું, અંતર્બાહ્ય શુદ્ધિ થઈ આપણી ઉન્નતિ થાય તે માટે સદ્‌ગુરુ શ્રી ઇમામશાહ મહારાજે કેટલાક મહત્ત્વના નિયમો કહ્યા છે તેને 'શિક્ષાપત્રી' અથવા 'શિખામણ' કહે છે. સાધકોએ તે પ્રમાણે વર્તવું. જ્ઞાન એ માત્ર શ્રાવણ કે મનન માટે નથી પણ પ્રત્યક્ષ આચરવા માટે છે. સદ્‌ગુરુ શ્રી ઇમામશાહ મહારાજ કહે છે—

ભાઈ કરણી બીના કેમ પામીયે. જેની કરણી સીધા ભલા કાજ ।
ભાઈ કસણી અમુલખ તોજાણો, અને કસણી ખમી તે ભલી જાત ॥
આજ કસણી ક્રિયા ધરમની, તેણે કલજુગ ન લોપે કોય ।
આગમ સદ્‌ગુરુ, ભાકિયા. તેણે દર્શન પ્રભુના થાયે ॥

શુદ્ધ ક્રિયા વગરનું જ્ઞાન ફોગટ છે. મનુષ્ય વેદશાસ્ત્રમાં ગમે તેટલો સંપન્ન હોય છતાં તે મુજબ તેનું આચરણ ન હોય તો તેને મહામૂર્ખ સમજવો જેની કરણી મહાન તેજ મહાન જાણવો. હે મુનિવર ! તારી કરણીથી જ તને શ્રેષ્ઠત્વ મળશે. વેદ અને શાસ્ત્રમાં બતાવેલા નિયમોનું બરાબર પાલન કર, તેથી મહાન કાર્ય થઈ માનવ જન્મ સફળ થશે. આવું આચરણ કરવામાં ઘણા કષ્ટો પડે છે છતાં એવા આચરણથી જ મુક્તિ મળે છે. પહેલાના ત્રણ યુગોમાં સદ્ ધર્માચરણ માટે જેમણે મહાન કષ્ટ વેઠી કસોટી સહન કરી તે હિસાબે કળીયુગમાં કસોટી

realpatidar.com

https://archive.org/details/bk109/page/n7/mode/1up

realpatidar.com

ઘણું જ નાની છે. તેથી તું સદ્ધર્મનું આચરણ શ્રદ્ધાથી સારી રીતે કર. તેથી જ તને પરમેશ્વરના દર્શન થશે. માટે તન, મન, સમર્પણ કરી પરમભક્તિથી તેની ઉપાસના કરવી જોઈએ.

ભક્તિ એવી રે ભાઈઓ એવી, તરસાને છે પાણી જેવી ॥

તૃષાર્થને પાણીની ઘણી જરૂર હોય છે. પાણી વગર તે તરફડે છે. તેથી તેનું ધ્યાન જેમ પાણી તરફ હોય છે, તેવી રીતે આપણું ધ્યાન પરમેશ્વર તરફ હોવું જોઈએ. એમ થશે તોજ પરમેશ્વરનો સાક્ષાત્કાર થઈ શકશે અને જન્મ–મરણના ફેરા ટળી મોક્ષપદ મળી શકશે.

આ સત્ય માર્ગ સદ્‌ગુરુ ઈમામશાહ મહારાજે દુનિયાને બતાવ્યો છે. તેના આચરણથી શાંતિ અને મુક્તિ મળે છે. આપણા ઋષિમુનિ અને પૂર્વજોનો જેનાથી ઉદ્ધાર થઈ તે પરમાત્મા-પદે પહોંચ્યા, તે જ અનાદિકાળથી ચાલતો આવેલો 'સનાતન વૈદિક યુગધર્મ' છે. સદ્‌ગુરુ શ્રી ઈમામશાહ મહારાજે કહ્યું છે કે—

આ સંસાર સાગરને વચમાં । અને નાવ ધરી છે દોય રે ॥
તેમાં એક ફૂટીને એક સાજીયા । ભાઈ તારૂં મન માને તાહા જાય રે ॥
તે જુઠાને નાવ ફૂટી ભાવે । અને ફૂટી નાવ આજ આયે રે ॥
જે સતીને સાચી નાવ ભાવે । ભાઈ તે ફૂટી ના દેવે પાય રે ॥

હે મુનિવર! આ સંસાર–સાગરમાં બે પ્રકારની નાવડી છે. તેમાંની એક નાવડી બહારથી દરેક રીતે ઉત્તમ કળાથી સજાવટ કરેલી છે બહારથી એ સુશોભિત હોઈ મોહ પમાડે તેવી છે. પણ જોતાવેંત આકર્ષણ કરનારી આ નાવડી અસત્યની હોઈ અંદરથી તેને છિદ્રો પડેલા છે. તેનો નાવિક સદા બેદરકાર રહે છે. બીજી નાવડી દેખાવમાં તદ્દન સાદી અને બહારથી જોનારને નિસ્તેજ દેખાય છે. પણ તેને છિદ્રો નથી. તેથી જગતરૂપી નગરના પ્રવાસી પોતનો પ્રવાસ પૂરો કરી સંસાર–સાગર તરી જવા માટે બરાબર વિચાર કરી આ બે પૈકી સારી નાવડી પસંદ કરે છે. હે પ્રવાસી! દુર્ગંધિયુક્ત અને કાદવવાળા સંસારરૂપી ખાબોચિયામાં દેડકાની જેમ જીવવાની ઈચ્છા રાખીશ નહીં. સંસાર પરિણામે દુ:ખદાયક છે એ અસત્ય નૌકા છે. જેને સત્ય ગમતું નથી તે આ મોહમયી નૌકાનો આશ્રય લે છે પણ તે ફૂટેલી હોવાથી તેમાં પાણી ભરાઈ તે ડૂબે છે. સત્યનો આશ્રય લેનારા માયા મોહમાં લપટાતા નથી. તેથી તે સાદી દેખાતી સત્યની નૌકામાં બેસી પેલે પાર થઇ જાય છે.

અસત્યનો આશરો લેનારા અલ્પમતિ અને અજ્ઞાની હોય છે તેમાં બેસનારા પણ તેવાજ હોય છે. તેમના પાપરૂપી બોજાથી નાવડીમાં પાણી ભરાય છે અને કુબુદ્ધિરૂપ વંટોળિયો શરૂ થાય છે અને માયા સાગરમાં અહંતા મમતા કામક્રોધ વિગેરે મોટા મોટા મોજાં નિર્માણ થાય છે અને છેવટે નાવડી ડૂબે છે અને તેથી નાવિક અને મુસાફરો પણ પોતાના બોજા સાથે ડૂબે છે અને ગોથા ખાતા ખાતા જન્મ–મરણના ફેરામાં પડે છે પણ સત્યનો આશરો લેનારાનો નાવિક સદ્‌ગુરુ હોવાથી અને તેના પ્રવાસીઓ અનુભવના મજબૂત આધારને વળગેલા હોવાથી તેઓ અહંભાવ અને સંકલ્પ વિકલ્પરૂપ મુસીબતોનો સામનો કરવા સમર્થ હોય છે. સદ્‌ગુરુના ઉપદેશામૃતથી માયામોહથી અલગ રહી મોક્ષ પામે છે. તેમના સારા નરસા કર્મરૂપી પોટલા નિષ્કામ કર્મયોગાચરણથી છૂટી જાય છે અને તે નિત્યમુક્તાત્મા દાસબોધમાં કહ્યા મુજબ—

realpatidar.com

realpatidar.com

[૫]

"सद्‌गुरु भजना परते कांही । मोक्षदायक दुसरें नाही ॥
गुरुचें बचन प्रतिपाळण । है मुख्य परमार्थचे लक्षण ॥
सद्‌गुरु वचन हृदयो धरी । तोचि मोक्षाचा अधिकारी ॥

હે પ્રિય બંધુઓ ! જે સતી હોય તે જ સદ્‌ગુરુ ઈમામશાહ મહારાજે બતાવેલી સતની નાવડીમાં બેસશે; અને જ્યાંથી કદી પાછા ફરવાપણું રહેતું નથી તે પરમધામ પામે છે. આ વેદશાસ્ત્રાંતગર્ત માર્ગ છે. જ્યાં ચક્ષુવાણી કે મનની ગતિ નથી, જે વર્ણવી કે જાણી શકાતું નથી. જે અગમ્ય અગોચર અદ્વૈત અખંડ પ્રેમાનન્દ છે તે સત્ વિચત્ આનંદરૂપ પરમેશ્વરને જાણવાનો સતમાર્ગ–સતપંથ જેમણે બતાવ્યો છે તે પરમપૂજ્ય બ્રહ્મરૂપ વેદમૂર્તિ સદ્‌ગુરુ મહારાજને હું વંદન કરૂં છું.

सर्ववेदान्तसिद्धान्तथोचरं तमगोचरम ।
गोविन्दं परमानन्दं सद्‌गुरु प्रणतोऽस्म्यहम् ॥

સામાન્યતઃ જાણી શકાય નહિ પરંતુ વેદાન્તમાં સર્વ સિદ્ધાન્તથી જાણી શકાય એવા પરમપૂજ્ય આનન્દમૂર્તિ સદ્‌ગુરુને નમસ્કાર છે.

સદ્‌ગુરુ શ્રી ઈમામશાહ મહારાજનાં જીવનચરિત્રમાં કહ્યા મુજબ તે જ્યાં જ્યાં ગયા તે ઠેકાણેના લોકોને ઉપર પ્રમાણેનો ઉપદેશ તેમણે આપ્યો છે. આ પ્રમાણેનો યુગધર્મ સદ્‌ગુરુશ્રી ઈમામશાહ મહારાજે આપણી બધાની સમક્ષ મૂકયો છે. તેમણે કહ્યું છે કે "માન્યા તે અમરાપૂર ગયા । ન માન્યા તે ફેરામાં રહ્યા ॥" જેમણે આ સત્યધર્મને માન્યો અને તે પ્રમાણે આચરણ કર્યું તે જીવ મોક્ષગતિએ જાય છે. પણ જે સત્ય વસ્તુ જાણતા નથી તે અધોગતિએ જાય છે, તેથી સત–સાધકોએ જ્ઞાન યથાર્થપણે લઈ સદ્‌ગુરૂ શ્રી ઈમામશાહ મહારાજે કરેલ અમૂલ્ય જ્ઞાનોપદેશરૂપ રસનો આસ્વાદ વાચનરૂપે લેવો અને તેમના વચન પ્રમાણે વર્તન રાખી આત્મોન્નતિ કરી લેવી એજ એક સદિચ્છા.

(ક્રમશ....આવતા અંકે)

ADVERTISEMENT

The complete vacation in the Pennsylvania Dutch country
–U. S. A.

* Econo Lodge North/South on U. S. Hwy 30, East, Lancaster PA/7602, Call for reservation 011–717–299–6900 Or 001–717 -397–1900.
* Days Inn East on RTE 896 North, Ronks, PA 17572, Call for reservation 011–717–390–1800.
* Knights Inn on RTE 13 South, New Castle, DE 19720, Call for reservation 001–302–328–6691.

realpatidar.com

https://archive.org/details/bk109/page/n9/mode/1up

realpatidar.com

* કૃપા હોય જો ગુરૂદેવની.....! !! *

(બનેલી સત્ય ઘટનાઓ)

સતપંથ સંપ્રદાયના આદ્યગુરૂ શ્રી ઈમામશાહ મહારાજ તત્ત્વજ્ઞાની અને સાથો સાથ મહાન તેજસ્વી સુફીસંત હતા. તેઓએ મેળવેલી યોગ્યસિદ્ધિ અને બ્રહ્મજ્ઞાન લોક કલ્યાણ અર્થે અતિ મહત્ત્વના હતા. જે તેમના સેવકોના સુખદુ:ખમાં સહભાગી બની શ્રદ્ધા અને સુખના પૂરક બની રહ્યા.

આજે પણ સદ્ગુરૂ શ્રી ઈમામશાહ મહારાજ ઉપર શ્રદ્ધા રાખનાર અનેક નર-નારી અબાલ વૃદ્ધ કદી નિરાશ થતાં નથી, તેમની મનોકામના ચોક્કસ પૂર્ણ થાય છે. તેમના પરચા કે જે સત્ય ઘટના બની છે તેમાંના કેટલાક પરચાઓ અમો આ અંકમાં રજૂ કરતાં હર્ષ અનુભવીએ છીએ :-

આફત સમયે રક્ષણ મળવાનો પરચો :

ગત તા. ૨૬-૩-૯૪ ની રાત્રે અમો અમારી ફીયાટ ગાડી દ્વારા અમદાવાદથી આબુ જઈ રહ્યાં હતાં જ્યાં અમારી મારબલ ફેકટરી છે. ત્યાં રસ્તામાં નંદાસણથી આગળ બે કી. મી. રોડ ઉપર આડશ મુકી ચડ્ડી-બનીયાન ધારી સખ્સોએ અમારી ગાડી ઉભી રખાવી. તેઓએ અમારી ફીઆટના કાચ તોડી અમારી ઉપર હુમલો કર્યો. દરવાજો ખોલી મારા પતિને માર મારી ઢસડતા-ઢસડતા એકબાજુ ઝાડીમાં ખેંચી ગયા. તેઓને અર્ધ બેભાન હાલતમાં ગટરમાં ઝાડ સાથે બાંધી દઈ મારી બાજુનો દરવાજો ખોલી મારા દાગીના લુંટવા લાગ્યા, અને મને ગડદા-પાટુનો માર મારવા લાગ્યા !! આવા કપરા સમયમાં ગદ્ગદીત સ્વરે મારાથી બોલાઈ ગયું કે હે દુ:ખીયાં ના બેલી સદ્ગુરૂ ઈમામશાહ મહારાજ અમારી વહારે આવો !! અમને બચાવો !! ત્યાં તો આંખના પલકારામાં પોલીસની જીપ ત્યાં આવી પહોંચી !!! પોલીસને જોઈ લુંટારાઓ અંધારામાં ખેતરોમાં પોબારા ગણી ગયા !!! અમો એ બધી હકીક્ત પોલીસને જણાવી !! પોલીસે મારા પતિને ઝાડ સાથેથી છોડયા !! અમને આશ્વાશન આપ્યું !! અમોને અમારી ગાડીમાં બેસાડી પોલીસે કહ્યું કે તમો આગળ ચાલો અમો તમારી પાછળ પાછળ તમને મુકવા આવીએ છીએ. અમો થોડાક આગળ ચાલ્યા, અને પાછળ નજર કરી તો આ શું ? એકાએક પોલીસ અદ્દશ્ય થઈ ગઈ !!! પછી અમને અનુભુતિ થઈ કે આ પોલીસ નહોતી પણ સાક્ષાત સદ્ગુરૂ શ્રી ઈમામશાહ મહારાજ પોલીસનું રૂપ લઈ અમારી વહારે આવ્યા હતાં !!! અમને બચાવવા આવ્યા હતા !!! જે નિમિત્તે આજ રોજ તા ૧૭-૪-૯૫ ના રોજ સદ્ગુરૂની સમાધિ એ બાધા ઉતારી ઋણ મુક્ત થયાં છીએ !! ઉપરોક્ત સત્ય ઘટના અત્રે રજુ કરતાં હૃદય ભરાઈ આવે છે. !!

— સુનિલકુમાર પરીખ, આબુ-રાજસ્થાન,
— ચંપાબેન પરીખ, " "

realpatidar.com

https://archive.org/details/bk109/page/n10/mode/1up

realpatidar.com

પુત્ર રત્ન પ્રાપ્તિનો પરચો.

સદગુરૂ શ્રી ઇમામશાહ મહારાજની અસિમ કૃપાથી અમારૂ ગ્રહસ્થ જીવન સુખરૂપ ચાલતુ હતું, અમારા ગ્રહસ્થ જીવન દરમ્યાન ક્રમાનુસાર અમારે ત્યાં સાત દીકરીઓનો જન્મ થયેલ !!! આ સાતેય દીકરીઓને જોઈને અમોને વારંવાર એમ થયા કરતુ. કે આ સાતે બહેનો જેને " ભાઈ શબ્દથી સંબોધી શકે અર્થાત્ સાતે બહેનોને વીર પસલી પુરી પુરી પાડે શકે તેવા પુત્રનું આગમન થાય તો કેવું સારૂ !! આવા ખ્યાલ અને ઉમંગથી અમો અત્રે ગુરૂવારે આવી સદ્ગુરૂ શ્રી ઈમામશાહ મહારાજ ના સમાધિ સ્થળે નત્ મસ્તકે અમારી ઉપર મુજબની મનોકામનાની રજુઆત કરી અને સાથો સાથ પ્રતિજ્ઞા લીધી કે હવે જો અમારે ત્યાં પુત્રનો જન્મ થશે તો તે પુત્રને અત્રે સમાધિ સ્થળે બાબાને સાકર ભારોભાર તોળીશું, યથા શક્તિ પ્રમાણે અંખડ જયોત માં ઘી પુરાવીશું, ચાંદીનું એક પારણું ભેટ ધરીશું અને સમાધિ ઉપર ચાદર ચઢાવીશું !!! આવી પ્રતિજ્ઞા લીધા બાદ સાચે જ સદ્ગુરૂ શ્રી એ અમારી વિનંતી સાંભળી અમારે ત્યાં પુત્ર રત્નનો જન્મ થયો !! અમારી શ્રદ્ધા ફળી !! ઘરમાં બધે આનંદ આનંદ થયો. જે નિમિત્તે હર્ષ ઘેલો થઈ આજ રોજ તા. ૧૭/૩/૯૫ ના રોજ માનેલ માનતા પૂર્ણ કરી ઋણ મુક્ત થયો છું. સદ્ગુરૂશ્રીને અમારા સૌના કોટી કોટી વંદન.......

— રમેશચંદ્ર બાબુલાલ રાણા. બેગમપુરા–સુરત,

ડેપ્યુટી કલેકટર તરીકે નોકરી મળ્યાનો પરચો.

સદ્ગુરૂ શ્રી ઈમામશાહ મહારાજની અસિમ કૃપાથી મે, M. B. S C. ની ઉચ્ચ શૌક્ષણિક લાયકાત મેળવી પશુધન વિકાસ અધિકારી તરીકેનો હોદ્દો સંભાળતો હતો. પરંતુ મને ઘણા સમયથી એમ થયા કરતુ હતુ કે આના કરતાં કંઈક વિશેષ હોદ્દો મળે એટલે કે ડેપ્યુટી કલેકટરની પોસ્ટ મળે તો વધુ સારૂ ભવિષ્ય બની શકે, આ માટે મેં સદ્ગુરૂ શ્રી ઈમામશાહ મહારાજના સમાધિ સ્થળે દર્શને આવી બેડીઓ પહેરી !! તેમની આજ્ઞા મળતાં મારા ઉત્સાહ માં ઓર વધારો થયો. મેં નત્ મસ્તકે સમાધિ સ્થળે સદ્ગુરૂને પ્રાર્થના કરી કે જો મને ઉપરોક્ત હોદ્દો મળશે તો મારા હજાર કામ પડતાં મુકી સદ્ગુરૂ ને દર્શને આવીશ અને યથા શક્તિ ભેટ ધરીશ સાચે જ સદ્ગુરૂ શ્રી એ મારી મનોકામના ધાર્યા કરતાં બહુ વહેલી પૂર્ણ કરી મને ડેપ્યુટી કલેકટર તરીકેનો હોદ્દો મળી ગયો. મારા ઘરમાં સગાં વહાલામાં, મિત્ર મંડળમાં બધે આનંદ આનંદ વરતાયો, જે નિમિતે હર્ષ ઘેલો થઈ આજ રોજ તા. ૧૯–૪–૯૫ ના રોજ અત્રે દર્શનાર્થે આવી મારા પ્રથમ પગારની અડધી રકમ જનકલ્યાણ અર્થે સદ્ ઉપયોગ સારૂ ભેટ ધરી ઋણ મુક્ત થઉં છું. સદ્ગુરૂ શ્રીને મારા તથા મારા કુટુંબજનો ના કોટી કોટી વંદન !!

— ડૉ. સંજયકુમાર ગેદરાજ કોલતે, જલગાંવ– (મહારાષ્ટ્ર)

કલેઈમ પાસ થવાનો પરચો.

સદગુરૂ શ્રી ઇમામશાહ મહારાજની અસિમ કૃપાથી શાહવાડી–અમદાવાદ ખાતે દરેક રીતે સેટ થઈ રહું છું. તેવામાં મારે કોર્ટમાં મોટી રકમનો કલેઇમ હતો. તેમાં કોઈ વાતે ખુલાશો ન થયો દિવસો વહેતા જતા હતા. કલેઇમ પાસ ન થવાથી હું ઘણો જ હતાશ થઈ ગયો હતો.

realpatidar.com

https://archive.org/details/bk109/page/n11/mode/1up

realpatidar.com

તેવામાં દુઃખીયા નાં બેલી સદ્ગુરૂ શ્રી ઇમામશાહ મહારાજને મનોમન યાદ કરી અંતઃ કરણથી પ્રાર્થના કરી કે હે સદ્ગુરૂ આપ આમાંથી કંઈક સુખરૂપ રસ્તો કાઢી અમારી હતાશાને ઉત્સાહમાં બદલી નાંખવા કૃપાયમાન થશો.–જો આ કાર્યમાં સફળતા મળશે તો આપની સમાધિ સ્થળે દર્શનાર્થે આવી યથા શક્તિ ભેટ મુકીશ.... સાચે સદગુરૂશ્રીની અમારા ઉપર અમિ દ્ષ્ટ્રિ થઈ... ટુંક સમયમાં કલેઇમ પાસ થઈ ગયો....જેથી અમારા હર્ષનો પાર ન રહ્યો ઘરમાં મિત્ર મંડળમાં સગાંમાં બધે આનદ આનંદ થયો.... આર્થિક મુંઝવણ પણ દૂર થઈ !!! જે નિમિતે આજ રોજ તા. ૭/૪/૯૫ એ સમાધિ સ્થળે જનકલ્યાણ અર્થે સદઉપયોગ કરવા ભેટ ધરી ઋણ મુક્ત થયો છું. સદગુરૂશ્રી મારા કોટી કોટી વંદન

— મહેશકુમાર ઉમેદભાઈ પટેલ
શાહવાડી–અમદાવાદ.

શારીરીક તકલીફ દૂર થવાનો પરચો :-

સદ્ગુરૂશ્રી ઇમામશાહ મહારાજની અસિમ કૃપાથી હૈદરાબાદ ખાતે ધંધામાં સરસ રીતે સેટ થઈ દરેક રીતે સાધન સંમ્પન હતો. તેવામાં મને ગેસ્ટ્રીક તથા બી. પી. ની તકલીફ હોવાથી દરેક રીતે ઉદાસ અને હતાશ રહેવા લાગ્યો. આજુબાજુનાં નામાંકીત ડોકટરો પાસે ટ્રીટમેન્ટ લીધી પણ કોઈ ફરક ન જણાયો. તેવામાં દુઃખિયાનાં બેલી સદ્ગુરૂશ્રી ઇમામશાહ મહારાજને મારા પિતાશ્રીએ તા.૧૦/૧/૯૪ના રોજ અંતઃકરણથી સદ્ગુરૂને યાદ કરી મારા વિષે પ્રાર્થના કરી કે મારા પુત્રને જો શારીરીક તકલીફ દુર થઈ જશે તો હજાર કામ પડતાં મુકીને સૌ પ્રથમ આપની સમાધિ એ દર્શનાર્થે આવીશું. સવા પાંચ શેર ઘી અખંડ જ્યોતમાં પુરાવીશું. સવા પાંચ કીલો સાકરનો પ્રસાદ ધરાવીશું. અને પુજા ભરાવીશુ. આ લખેલ ચીઠી પિતાશ્રીના કોટના ખિસ્સામાંથી અચાનક મળી. તે પ્રમાણે આજ રોજ તા ૧૩/૪/૯૫ ના રોજ માનેલ માનતા પ્રમાણે પ્રસાદ ધરી ઋણ મુક્ત થયો છું. સદગુરૂશ્રીને લાખ લાખ વંદન

—સિવગણભાઈ રા. પોકાર. હૈદરાબાદ,

✻ રત્નકણિકા ✻

—કુ. કોમલ બી. પટેલ
બારસોલ–ખેડબ્રહ્મા.

— ધન કરતાં જ્ઞાન મોટું છે, કારણ કે ધનનું આપણે રક્ષણ કરીએ છીએ જ્યારે જ્ઞાન આપણું રક્ષણ કરે છે.
— જીવનને શ્રેષ્ઠ વિચારોની મૂડી જ સફળ બનાવે છે.
— સેવાની ભાવના વગરનું મન સ્મશાન જેવું છે.
— નિરાશા એ કાયરતાનું ચિહ્ન છે.
— સદ્ગુણો અને સદ્બુદ્ધિથી આત્મ ઉન્નતિ થાય છે. સંપત્તિથી નહિ.
— બાળકોને વારસામાં ધન કરતાં જ્ઞાનની વધારે જરૂર છે

realpatidar.com

https://archive.org/details/bk109/page/n12/mode/1up

realpatidar.com

શ્રી નિષ્કલંકી નારાયણ સતપંથ મંદિર, પ્રતિષ્ઠા મહોત્સવ

તા. ૧૦-૪-૯૫ થી ૧૧-૪-૯૫ કોટડા-ચકાર (ઉ) કચ્છ

કચ્છ જીલ્લાના ભુજ તાલુકામાં આવેલ કોટડા-ચકાર ગામે શ્રી નિષ્કલંકી નારાયણ સતપંથ મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ ઉપરોક્ત તારીખે ભવ્ય રીતે ઉજવાયો હતો.

આ શુભ પ્રસંગે તા. ૧૦-૪-૯૫ ના રોજ ઉપસ્થિત શ્રી સતપંથ પ્રેરણા પીઠના પ. પૂ. વિરવર આચાર્ય શ્રી કરસનદાસજી મહારાજ (સંરક્ષક અને પશ્ચિમાચલ ઉપાધ્યક્ષ શ્રી, અખિલ ભારતીય સંત સમિતિ, ગુજરાત પ્રદેશ) તેમજ સત કૈવલ સારસા પીઠના પ. પૂ. આચાર્ય શ્રી અવિચલદાસજી મહારાજ (ઉપાધ્યક્ષ, અખિલ-ભારતીય સંત સમિતિ) શ્રી સ્વામી નારાયણ ગુરૂકુળ, ઝુંડાલ,જી ગાંધીનગરના શાસ્ત્રી પુરૂષોત્તમ ચરણદાસજી સ્વામી (ઉપાધ્યક્ષ, અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશ) શ્રી સ્વામી નારાયણ મંદિર, માતર, જી. ખેડા ના મહંત શ્રી ધનશ્યામદાસજી મહારાજ, શ્રી વાંઢાય આશ્રમ કચ્છના સંતશ્રી હરિદાસજી મહારાજ, મોટી કદ્રાણી જાગીર કચ્છના સંતશ્રી ધર્મેન્દ્રગીરી બાપુ, જયઅંબે મંદિર ગઢશીશા-કચ્છના સંત સાધ્વી શ્રી ચંદુબા અને ગઢડા શામળીયા મંદિર-ખેડબ્રહ્મા ના સાધ્વી શ્રી વંદનાબેન તેમજ શ્રી નાયાકાકા સતપંથ મંદિર, કુકસ જી. વડોદરા ના ગાદીપતિ શ્રી સવગણદાસજી મહારાજ શ્રી નિષ્કલંકી નારાયણ સતપંથ મંદિર, દિવાળીપુરા જી. વડોદરાના સંતશ્રી સોમદાસજી મહારાજ, સતપંથ મંદિર ફૈજપુર (M. S.)ના મહંતશ્રી જગન્નાથજી મહારાજ, પંચવટી દહેગામ ના સંતશ્રી પ્રેમદાસ બાપુ, નિવૃતી આશ્રમ નાના અંગીયા. કચ્છ ના સંતશ્રી ભાણદાસ બાપુ અને વાલ્મીકી સીતારામ પરિવાર પંચમહાલના વનવાસી સંતશ્રી રમણભાઈ ભગત તેમજ નામી અનામી સંતો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

પધારેલા સંતોનું ભવ્ય સ્વાગત સામૈયુ "કમળ અને શેષનાગનું છત્ર" જેવા શુશોભીત વાહનમાં પ. પૂ. વિરવર આચાર્ય શ્રી કરસનદાસજી મહારાજ અને પૂ. આચાર્ય શ્રી અવિચલદાસજી મહારાજ બન્ને તેમના તેજસ્વી મુખારવિંદથી દેવ સમાન શોભા યાત્રામાં સૌ ભાવિકજનોને પોતાના કરકમળથી આશીર્વાદ આપી રહ્યા હતા. સાથે આવેલા સંતો અને મહાનુભાવો માટે શોભાયાત્રામાં અલગ વાહનની વ્યવસ્થા કરી હતી. આ શોભા યાત્રાએ બપોરના બે વાગે કોટડા ગામમાં પ્રવેશ કર્યો હતો. ત્યારે હજારોની સંખ્યામાં માનવ મહેરામણ દર્શન માટે ઉમટયો હતો. અબાલ-વૃધ સૌનાં હૈયાં હર્ષથી નાચી રહ્યા હતાં. આ પ્રસંગને પોતાના જીવનની ધન્ય ઘડી માની સૌ ઉનાળાની અસહ્ય ગરમી ને પણ ભુલી ગયાં હતાં. અને ચકાર કોટડા જાણે ચિકાર કોટડા બની ગયું હતું.

આમ શોભાયાત્રા કોટડા ગામમાંથી પસાર થઈ વિશાળ સમિયાણામાં આવી ધર્મ સભાના બની હતી. ઉપસ્થિત સંતોએ મંચ ઉપર આશન શોભાવ્યુ' હતું. સંતોનું ફુલહારથી સ્વાગત કરી ગ્રામજનોએ પૂજન-આરતીનો લ્હાવો લીધો હતો. ત્યાર બાદ સંતો અને મહાનુભાવોએ પ્રાસંગીક પ્રવચનો કર્યો હતાં.

સૌ પ્રથમ ભુજ નગર પાલિકાના માજી-મેયર શ્રી કરસનબાપા એ શબ્દોથી સૌનું સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના પ્રમુખ શ્રી મણીબાપા એ પ્રાસંગિક પ્રવચ કર્યું હતું. અને

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk109/page/n13/mode/1up

realpatidar.com

કહ્યું હતું કે આજનો દિવસ આનંદનો દિવસ છે. આ સમાજની ગંગામાં મને સાક્ષાત નારાયણનાં દર્શન થાય છે. આપણે ગમે તે સ્વરૂપે નારાયણ ભગવાનને માનીએ પણ મંદિરો થાય તો સંસ્કૃતી જળવાઈ રહે. અને સમાજને શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરવા પર ખાસ ભાર મુકયો હતો. આવા સમાજની ઉન્નતીના કાર્યો માટે પ. પૂ. આચાર્યશ્રી કરસનદાસજી મહારાજે જે આ વિરાટ પગલુ ભર્યું છે તે આવકારદાયક છે. શ્રી ઇમામશાહ મહારાજ સંસ્થાનના ટ્રસ્ટીશ્રી રતિભાઈ કે. પટેલે યુવાન ભાઈ–બહેનોને ધાર્મિક, શૈક્ષણિક અને સામાજીક કાર્યો માટે આગળ આવવાની ખાસ જરૂર છે. વિશ્વક્રાંતીની શરૂઆત અખિલ ભારતીય સંત સમિતિના દશમા અધિવેશન પ્રેરણાપીઠથી શરૂ થઈ છે. સતપંથનો સુરજ સોળે કળાએ આખા વિશ્વમાં પ્રકાશ ફેલાવશે તેવું મંતવ્ય રજુ કર્યું હતું. ત્યાર બાદ સંતશ્રી પ્રેમદાસ બાપુએ કચ્છના લોકોના દિલ અને દિમાગ જોઈ, તેમના ઉત્સાહ અને મહેનત જોઈ કચ્છ ભુમિને બિરદાવી હતી. અને અમેરીકાની વૈજ્ઞાનિક અને રાજકીય શક્તિની તુલના કરી કે અમેરીકાને કોઈ હરાવી શકે તેમ નથી. પરંતુ ધાર્મિક અને સામાજીક ક્ષેત્રે ત્યાં શાંતિનો અભાવ જણાય છે. થોડાક દિવસો પહેલાં અમેરીકાના પ્રમુખનાં પત્નિ ભારતની મુલાકાતે આવ્યાં હતાં અહીં અનેક ભાષાઓ અનેક સંપ્રદાયો હોવા છતાં ભારતની સંસ્કૃતીથી પ્રભાવિત થઈ આનંદ વિભોર બની ગયાં હતાં. માટે યુવાન મિત્રો ધર્મએ આપણા જીવનનું અંગ છે. ધર્મ જોડવાનું કામ કરે છે. તોડવાનું નહીં.

ત્યારબાદ સંતશ્રી હરિદાસજી મહારાજે પોતાના ઉદ્બોધનમાં ગુરૂવંદનાથી શરૂઆત કરી શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાનની જય, શ્રી ઉમિયામાતાની જય સાથે જણાવ્યું હતું કે શ્રી નિષ્કલંક ભગવાનના ઉપાસક કરશનદાસજી મહારાજે સમાજમાંથી કલંક દુર કરવાનું ભગીરથ કાર્ય કર્યું છે તે પ્રસંશનીય છે. મારી જ્યારે જરૂર પડે ત્યારે અડધી રાત્રે મારો દરવાજો ખખડાવવો. સાધુનું જીવન સમાજના કલ્યાણ માટે છે પોતાના માટે નહીં. ત્યારબાદ આશીર્વચન પાઠવ્યા હતા. આ સમયે પ. પૂજ્ય આચાર્ય શ્રી કરશનદાસજી મહારાજે સંત શ્રી હરિદાસજી મહારાજને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. સંત શ્રી હરિદાસજી મહારાજે આ પ્રસંગે રૂા. ૫૦૦૧/–ની ભેટ શ્રી નિષ્કલંકી નારાયણ સતપંથ મંદિર– કોટડાને અર્પણ કરી હતી.

ત્યારબાદ મહંતશ્રી ધનશ્યામદાસજી મહારાજે શોભાયાત્રાની પ્રશંસા કરી હતી અને ગામમાં મંદિર શા માટે છે જેમ દવાખાનું આરોગ્ય કેન્દ્ર છે. તેમ મંદિર સંસ્કાર કેન્દ્ર છે. જેમ શિક્ષણમાંથી ડૉકટરો, વકીલો બને છે તેમ મંદિરમાંથી માનવ બનવા માટેના સંસ્કારો મળે છે. અરે માનવમાંથી દેવ બની શકે છે. આ ડીગ્રી કોલેજમાંથી મળતી નથી. સદ્ગુરુ ઇમામશાહ મહારાજની શિક્ષાપત્રી એ કાયદાપોથી છે. માનવમાંથી દેવ બનવાની કળા તેમાં છે. મંદિરમાં દર્શન કરવા માટે, વડીલો અને બાળકોને સુચન કર્યું હતું ત્યારબાદ શ્રી પુરૂષોત્તામ ચરણદાસ સ્વામીએ પોતાના ઉદ્ગારો વ્યક્ત કર્યા હતા. કે મને જ્યારે કોટડાના સતપંથીભાઈઓ તરફથી પત્રીકા મળી ત્યારે એમ થયું કે કોટડા કેવું હશે ? શું હશે ? ચકાર કોટડા એટલે શું ? પણ સ્વાગત, સામૈયું અને શોભાયાત્રા જોઈ ત્યારે એમ લાગ્યું કે, આ તો ચકાર કોટડા નહીં પણ ચિકાર કોટડા છે. કયાંય ખાલી નથી, નિષ્કલંકી નારાયણ મંદિરની પ્રતિષ્ઠા સહ આનંદ વ્યકત કર્યો હતો. વધુમાં કહ્યું હતું કે માણસને મોટાઈ મળ્યા પછી મનમાં અસમાનતા ઉભી થાય છે. નાના મોટાના ભેદ મિટાવવા માટે આજે શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાનની પ્રતિષ્ઠા કરાવીને સરોવર નહીં

realpatidar.com

realpatidar.com

રાખજો. પૂજ્ય આચાર્ય શ્રી કરસનદાસ મહારાજના આદેશનું પાલન કરજો. શ્રી ઈમામશાહ મહારાજ સુફી સંત હતા. હિન્દુ સંસ્કૃતિના હિમાયતી હતા. મોગલ સામ્રાજ્યના સમયમાં હિન્દુ સંસ્કૃતિને જાળવવા તેમણે દેખાવ માટે પ્રયત્ન કર્યા હતા. આપણા હ્રદયમાં વસતા શ્રી ઈમામશાહ મહારાજ તે પોતે જ ત્રિભોવન પતી છે. માટે ઉઠો, જાગો અને જગાડો શિક્ષાપત્રીનું પાલન કરજો, નિષ્કલંક બનીને રહેજો. અને નિષ્કલંકી નારાયણનું રટણ કરજો તેવા આશીર્વાદ આપ્યા હતા.

ત્યારબાદ સંત સાધ્વી શ્રી ચંદુબા ગઢશીશા તેમણે કહ્યું હતું કે આ વિરાટ જનમેદનીમાં જોઉં છું ત્યારે બહેનો અને માતાઓમાં મને સાક્ષાત જગદંબા "મા અંબાજી"નાં દર્શન થાય છે ને ભાઈઓ અને વડીલો તરફ જોઉં છું. ત્યારે સાક્ષાત નારાયણના દર્શનની ઝાંખી થાય છે. આ પ્રભાવ સદ્દગુરૂશ્રી ઈમામશાહ મહારાજનો છે. સંતોના પ્રતાપે આવા ભગીરથ કાર્યો થઈ શકે છે. સંતોના સાનિધ્યમાં જવાથી જ્ઞાન અને ભક્તિની ફળશ્રુતિ સાંપડે છે. આ માનવ મેદનીમાંથી કેટલાકને સંત બનવાની જીજ્ઞાશા પ્રાપ્ત થાય છે આ બધો સંતોનો પ્રતાપ છે. માટે મારી તો જગદંબાને પ્રાર્થના છે કે
" સંતો જીઓ હજારો સાલ,
તમને વંદન વારંવાર. વંદન વારંવાર તમને–
લાખો હૈ પ્રણામ, ગુરૂદેવ જીઓ હજારો સાલ.
તમને વંદન વારંવાર

આ પ્રસંગે કોટડા ગામના મહિલા મંડળના આગેવાને શ્રી ચંદુબાને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.

ત્યારબાદ શ્રી અવિચલદાસજી મહારાજે શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે મોગલ સામ્રાજ્યની વાત ઉપર ભાર મૂકયો હતો. અને કહ્યું હતું કે શ્રી ઇમામશાહ મહારાજ સંસ્થા પીરાણા જ નહીં પણ તે સમયે ડાકોર અને સારસાપુરીના મંદિરો ઉપર મિનારા જેવાં પ્રતિક બનાવવાં પડયાં હતાં અને આજે પણ છે. તે હિન્દુ સંસ્કૃતીને બચાવવા માટે જેથી કંઈ ડાકોર, સારસાપુરી કે પીરાણા તે મુસ્લીમ સંસ્થા નથી. બીજી વાત આવા મંદિરો બનાવજો. મંદિરમાં નિયમિત, પ્રાર્થના, સંધ્યા-પાઠ કરજો. અને ધર્મ માટે વાપરેલા પૈસા તે વાવ્યા ગણાય. વાપર્યા ગણાય નહીં. વાવેલું હોય તે અનેકગણું ઉગી નિકળે છે. વાપરેલું પાછું આવતું નથી, આહાર, વિહાર શુદ્ધ હોય તો શરીર અને મનની તંદુરસ્તી જળવાઈ રહે છે. તો શિક્ષાપત્રીનો પાઠ કરજો. માનવમાંથી દેવ બનવા માટે પ્રયત્ન કરજો એવા શુભ આશીર્વાદ પાઠવ્યા હતા.

ત્યાર બાદ સતપંથ મંદિર ફૈજપુર મહારાષ્ટ્રના મહંતશ્રી જગન્નાથજી મહારાજે તેમની હિન્દી ભાષામાં વ્યક્તત્વ રજુ કર્યું હતું. કે સદગુરૂ શ્રી ઈમામશાહ મહારાજે ચોવિશે મુલકમાં ફરી અઢારે વર્ણને સતપંથનો મહિમા સમજાવ્યો હતો. અને વિષ્ણુ ભગવાનના દશ અવતારનું વર્ણન કરી. છેલ્લા કલીયુગના સ્વામીશ્રી નિષ્કલંકી નારાયણ ભગવાનનું પુજન આરતી ધ્યાન જપ નિયમ વગેરેથી જીવનું કલ્યાણ થશે. તેવું મુળબંધ નામના ગ્રંથમાં વર્ણન કરેલ છે. તેમ જણાવી આશીર્વચન પાઠવ્યાં હતાં ત્યાર બાદ પરમ પૂજ્ય વિરવર આચાર્યશ્રી કરશનદાસજી મહારાજે ઉદ્દબોધન કર્યું હતું કે. શ્રી નિષ્કલંકી નારાયણ મંદિરની પ્રતિષ્ઠા નિમિત્તે વિશાળ સંખ્યામાં સતપંથી ભાઈઓનાં દર્શન થાય છે. આ વિશાળ સમિયાણું નાનું પડયું. તમારા બધાની ભાવના જોઈ હું ગદગદીત થયો છું. વધુમાં કહ્યું હતું કે. આપણી સંસ્કૃતી શ્રી ઇમામશાહ મહારાજે બતાવી છે. તેમાં માતાપિતાએ આપણું જન્મનું

realpatidar.com

https://archive.org/details/bk109/page/n15/mode/1up

realpatidar.com

ઝાડ છે. તેની સેવા કરી યોજાય છે. વડોદરા જીલ્લાના દિવાળી પુરા ગામનો પ્રસંગ ભવ્ય થયો. આદિવાસીઓ પણ આચાર સંહિતામાં માને છે. અને પવિત્ર છે. ઈમામશાહ મહારાજનો પ્રભાવ છે. સતસંગ રૂપી દ્રષ્ટાંતો આપ્યાં હતાં જેમાં. એક કસાઈ અને સંસ્કારી ધાર્મિક ભકત, કસાઇની પ્રાર્થનાથી ભગવાને ચાર પૂત્રો આપ્યા. અને ભક્તની પ્રાર્થના સાંભળી ભગવાને કહ્યું કે સારા જીવોનો સ્ટોક નથી જેથી તને રાહ જોવી પડશે, તો સારા સંસ્કારી બનીએ અને પ્રભુ રાજી રહે તેવાં સદકાર્યો કરીએ, તેમજ "ગાંડાની-હોસ્પીટલનું દ્રષ્ટાંત આપી આ સંસાર રૂપી હોસ્પીટલમાંથી બહાર નિકળી પ્રભુમય બનીએ, મનુષ્ય જીવનમાં હર, હર, અને હાય, હાય. આ બે રસ્તા છે. તો જીવનમાં કયો રસ્તો લેવો તે વિચારવાનું છે આવા માર્મિક શબ્દોથી આપણુને સમજાવ્યા હતા. છેલ્લે આશીર્વચન પાઠવ્યા હતાં, અંતમાં આજની ધર્મ સભાની આભાર વીધી કરી, સભાનું વિસર્જન કર્યું હતું. રાત્રે આ સમિયાણામાં કવિશ્રી શામજીભાઈ, અને રમણભાઈ વનવાસી, તેમજ શ્રી જેઠાબાપા દહેગામ અને જય ભગવાનના નામથી જાણીતા. શ્રી શામજીબાપા. તેમજ અન્ય ભાવિકજનોએ, સતસંગ. ભજન ધૂનથી અખંડ જાગરણ કર્યું હતું.

તા. ૧૧-૪-૯૫ સવારના ૭-૦૦ વાગે ધર્મસભાની બીજી બેઠકનું આયોજન થયું હતું. જેમાં મંચ પર બિરાજમાન સંતોનું ફુલહારથી સ્વાગત અને પૂજન બાદ, વનવાસી, રમણભાઇ ભગતે પોતાની ગામઠી ભાષામાં પ્રવચન કર્યું કે આ વિશાળ સમિયાણામાં માનવ ભેદની શોભી રહી છે. સતપંથની જયોત ગામડે, ગામડે જળકી ઉઠે. અને ચોમેર ફેલાય. બાળકોમાં સતપંથનો સંસ્કાર વારસો મળી રહે, હું જ્યારે છેલ્લા એક વર્ષથી ઈમામશાહ મહારાજના દર્શને આવું છું. ત્યારથી ગામડે ગામડે સદગુરૂજીની વાણીનો પ્રચાર કરૂં છું અમારા આદિવાસી બાળકોમાં જાગૃતી આવી છે. તે ઈમામશાહ મહારાજનો પ્રભાવ છે, અને છેલ્લે "યાદ રહેઓ આબાદ હૈ, ભુલે તે બરબાદ હૈ"

ત્યાર બાદ, ગાંધીધામ કચ્છના યુવા કાર્યકર શ્રી મોહનભાઈ એમ. પટેલે કહ્યું હતું કે-બાળ શિબિરોમાંથી બાળકોએ જ્ઞાન મેળવ્યું છે તેનો પુરાવો. ગામડે, ગામડે, જોવા મળે છે. આપણા પ. પૂજ્ય આચાર્ય શ્રી કરશનદાસજી મહારાજ ધર્મ ધ્વજા લઈને શહેરોમાં અને ગામડે ગામડે શાંતીનો સંદેશ પહોંચાડી રહ્યા છે. કોટડા ગામના ઉત્સાહી ભાઈઓએ સંકલ્પ કર્યો હતો તેનું ઉદાહરણરૂપ આ શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાનનું ભવ્ય મંદિર છે, તેનો આજે પ્રતિષ્ઠા મહોત્સવ છે. ત્યારબાદ ઈમામશાહ મહારાજ સંસ્થાના ટ્રસ્ટી શ્રી રતીભાઈ કે. પટેલે કહ્યું કે કચ્છની ભૂમી શુરવીરો, સંતો અને દાતાઓની ભૂમી છે. આજે શુભ અવસરે મંદિરની પ્રતિષ્ઠા નિમિત્તે સૌ ભાવિકજનો જરૂર હાથ લંબાવશે. આ કામ આપણા સૌનું છે. એમ. સમજી ઉપાડી લઈશું. આ મંદિર અનંતકાળ સુધી જીવંત રહેશે. અને આપણી ભાવી પેઢીને સતપંથનો સંસ્કાર વારસો આપતું રહેશે. આ પ્રસંગે સહયોગી બનેલા દાતાઓનાં નામ અમર બની જશે. વાવણીનો સમય છે. જરૂર વાવજો, વાવેલું અનેક ઘણું ઉગી નિકળશે, ત્યારબાદ નાના અંગીઆ-કચ્છના સંતશ્રી ભાણદાસબાપુએ મંદિરના દાતાઓના હૈયામાં જાગૃતી આવે તેવું સંબોધન કર્યું હતું. અને તરત જ દાતાઓ તરફથી દાનનો પ્રવાહ શરૂ થયો હતો.

realpatidar.com

https://archive.org/details/bk109/page/n16/mode/1up

realpatidar.com

ઉપરોક્ત પ્રસંગ નિમિતે નીચેના દાનવીરોએ દાનની ગંગા વહેવડાવી હતી.

(૧) મંદિરનું પ્રવેશ દ્વાર ખુલ્લુ મુકવાનો ચઢાવો. રૂા. ૯૭૧૧૧/–
શ્રી વસરામભાઈ સવજીભાઈ ધોળુ–કોટડા (ચ) ઉગમણા.

(૨) શ્રી નિષ્કલંકી નારાયણના સિંહાશનની પધરામણીનો ચઢાવો. રૂા. ૧,૧૦,૧૧૧/–
શ્રી પચાણભાઈ રામજીભાઈ ધોળુ–કોટડા (ચ) ઉગમણા.

(૩) શ્રી આધ શક્તિ માતાની જ્યોતી પ્રાગટયનો ચઢાવો. રૂા. ૧,૩૫,૧૧૧/–
શ્રી દેવશીભાઈ વાલજીભાઈ ભગત. કોટડા (ચ) ઉગમણા.

(૪) શ્રી ધર્મ ધજા આરોહણ રૂા. ૧,૭૦,૧૧૧/–
શ્રી કાનજીભાઈ વાલજીભાઈ ભગત કોટડા (ચ) ઉગમણા.

(૫) શ્રી નિષ્કલંકી નારાયણ મંદિરના શિખરે કળશ આરોહણ રૂા. ૧,૬૦,૧૧૧/–
શ્રી લખુભાઇ વીરજીભાઇ ધોળુ દુર્ગાપુર જી. કચ્છ.

(૬) શ્રી ત્રીદેવ જ્યોતિ પ્રાગટ્ય (બ્રહ્મા, વિષ્ણુ, મહેશ) રૂા. ૧,૦૫૧૧૧/–
શ્રી કાનજીભાઈ લાલજીભાઈ ધોળુ કોટડા (ચ) ઉગમણા.

(૭) સર્વદેવોને ધૂપ લોબાન રૂા. ૯૦,૧૧૧/–
શ્રી વાલજીભાઈ હીરજીભાઈ ધોળુ કોટડા (ચ) ઉગમણા

(૮) નોબત–આરતી વગાડવા માટે રૂા. ૧,૦૦,૧૧૧/–
શ્રી વસરામભાઈ સવજીભાઈ ધોળુ. કોટડા (ચ) ઉગમણા.

(૯) મુખીની ગાદી સ્થાપના માટે રૂા. ૯૫,૧૧૧/–
શ્રી સતપંથ સમાજ કોટડા (ચ) આથમણા હસ્તે શ્રી વાલજીભાઈ

(૧૦) પુજાવિધિના સેવક માટે રૂા. ૮૫,૧૧૧/–
શ્રી દેવજીભાઈ વાલજીભાઇ ભગત કોટડા (ચ) ઉગમણા.

(૧૧) કળશમાં જળ રૂપી વિષ્ણુનું આહવાન કરવા માટે. રૂા. ૯૦,૧૧૧/–
(૧) શ્રી રામજીભાઇ જેઠાભાઇ ધોળુ કોટડા (ચ)
(૨) શ્રી રામજીભાઇ ગોવિંદભાઇ ધોળુ કોટડા (ચ)

(૧૨) દેવોને ફુલહાર વિધિ માટે રૂા. ૫૧,૧૧૧/–
શ્રી સતપંથ સમાજ પાંતિયા જી. કચ્છ
હસ્તે હરીભાઈ વાલજીભાઈ પટેલ

(૧૩) સર્વ દેવોની આરતી ઉતારવા માટે રૂા. ૬૫,૧૧૧/–
શ્રી અરજણભાઈ ભાણજીભાઈ માંકાણી કોટડા (ચ) ઉગમણા.

realpatidar.com

https://archive.org/details/bk109/page/n17/mode/1up

realpatidar.com

(૧૪) પુજા પ્રસંગે દેવોને ચમર ઢળાવવા માટે — રૂા. ૭૨,૧૧૧
શ્રી સતપંથ સમાજ, ખેડોઈ–કચ્છ
હસ્તે (૧) રામજીભાઈ અખઈભાઈ પટેલ ખેડોઈ–કચ્છ
(૨) ધનજીભાઈ વાલજીભાઈ પટેલ "

(૧૫) શ્રી બ્રહ્માજીને થાળ જમાડવા માટે — રૂા. ૪૫,૧૧૧/–
શ્રી સતપંથ સમાજ થરાવડા, કચ્છ.
હસ્તે શ્રી નારણભાઇ મુખી,

(૧૬) શ્રી વિષ્ણુ ભગવાનને થાળ જમાડવા માટે — રૂા. ૪૦,૧૧૧/–
શ્રી સતપંથ સમાજ, જબલપુર, કચ્છ
હસ્તે શ્રી કાનજીભાઈ અને ડાહ્યાભાઇ

(૧૭) શ્રી મહેશ્વર ભગવાનને થાળ જમાડવા માટે — રૂા. ૪૦,૧૧૧/–
શ્રી જેઠાભાઇ વિશ્રામભાઈ ભગત, કોટડા (ચ) ઉગમણા.

(૧૮) શ્રી આદ્યશક્તિને થાળ જમાડવા માટે — રૂા. ૪૦,૧૧૧/–
M/S ગુરૂકૃપા વાસણ ભંડાર, કોટડા (ચ) ઉગમણા.
હસ્તે ધનજીભાઇ અને ઈશ્વરભાઇ

(૧૯) સર્વ દેવોને થાળ જમાડવા માટે — રૂા. ૪૧,૧૧૧/–
શ્રી સતપંથ સમાજ, નાની ખાખર–કચ્છ.
હસ્તે કરમશીભાઈ પટેલ

(૨૦) પુજા સમયે આરતી/ઝાલર વગાડવા માટે — રૂા. ૨૫,૧૧૧/–
શ્રી કાનજીભાઈ ગોવિંદભાઈ ધોળુ કોટડા (ચ) ઉગમણા

" અન્ન સમી નહી ઔષધી ઝરણા સમો નહી જાપ, "
" નિષ્કલંક નારાયણ સમા નહી દેવતા. નિંદા સમુ નહી પાપ. "

ઉપરોક્ત શુભ પ્રસંગે ઉપસ્થિત જન સમુદાયને નીચેના દાનવીરો તરફથી બ્રહ્મભોજન આપવામાં આવ્યું.

તારીખ	સમય	દાતાશ્રી	ગામ
૧૦–૪–૯૫	સાંજ	શ્રી સતપંથ સમાજ	કોટડા ચકાર
૧૧–૪–૯૫	બપોરે	શ્રી કાનજીભાઇ વાલજીભાઇ ભગત	કોટડા (ચ) ઉગમણા

realpatidar.com

https://archive.org/details/bk109/page/n18/mode/1up

realpatidar.com

શ્રી નિષ્કલંકી નારાયણ સતપંથ મંદિર, પ્રતિષ્ઠા મહોત્સવ

લવાડ ફાર્મ – દહેગામ જી. અમદાવાદ.

આ મંગલમય પ્રસંગે તા. ૨૨–૪–૯૫ ના રોજ ઉપસ્થિત શ્રી સતપંથ પ્રેરણા પીઠના પ. પૂ. વીરવર આચાર્યશ્રી કરસનદાસજી મહારાજ તથા હીયોલી આશ્રમ કૈલાશ ટેકરી (ઈડર) ના મહામંડળેશ્વર શ્રી કૃષ્ણાનંદ સરસ્વતીજી, શ્રી સ્વામીનારાયણ મંદિર, માતર જી. ખેડાના મહંતશ્રી ઘનશ્યામદાસજી મહારાજ, શ્રી સતપંથ મંદિર, ફૈજપુર–M.S.ના મહંત શ્રી જગન્નાથજી મહારાજ, તથ. શ્રી નાયાકાકા સતપંથ મંદિર કુકસ જી. વડોદરાના ગાદીપતી શ્રી સવગણદાસજી મહારાજ તેમજ સતપંથ મંદિર દિવાળીપુરા જી. વડોદરાના શ્રી સોમદાસજી મહારાજ તથા વાલ્મીકી સીતારામ પરિવાર પંચમહાલના વનવાસી સંતશ્રી રમણભાઈ ભગત, તથા પંચવટી દહેગામના સંતશ્રી પ્રેમદાસ બાપુ તેમજ શ્રી જયભગવાન અને સંત જેઠાબાપા તેમજ નામી અનામી સંતો, મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ શુભ પ્રસંગે પધારેલા સંતોનું ભવ્ય સ્વાગત સામૈયું " સતપંથ એર " ના વિમાનમાં પ. પૂ. આચાર્ય શ્રી કરસનદાસજી મહારાજ અને મહામંડળેશ્વર શ્રી કૃષ્ણાનંદ સરસ્વતીજી બિરાજમાન થયા હતા. સાથે આવેલ સંતો અને મહાનુભાવો માટે અલગ વાહનની વ્યવસ્થા કરી હતી. આ શોભાયાત્રા M/S જે. કે. ટાઇલ્સ દહેગામના પટાંગણમાંથી પ્રસ્થાન થઈ વાજતે ગાજતે જાહેરમાર્ગથી દહેગામ શહેરમાં વેપારી મંડળ અને ધારાસભ્યશ્રીએ આચાર્યશ્રીનું ફુલહારથી સ્વાગત કર્યું હતું. હજારોની સંખ્યામાં ઉમટેલી માનવ મેદનીએ દર્શનનો લાભ લીધો હતો. ઉનાળાની કારમી અસહ્ય તાપ–ગરમી હોવા છતાં અસંખ્ય અબાલ–વૃદ્ધ સૌના હૈયાં હર્ષથી નાચી રહ્યાં હતાં. ત્યારબાદ આ શોભાયાત્રા દહેગામ શહેરમાંથી પસાર થઈ " લવાડ–ફાર્મ " ના વિશાળ શામિયાણામાં ધર્મ સભાના રૂપમાં ફેરવાઈ હતી. ઉપસ્થિત સંતોએ મંચ પર આશન શોભાવ્યું હતું. સંતોનું ફુલહારથી સ્વાગત કરી ગ્રામજનોએ પૂજન–આરતીનો લ્હાવો લીધો હતો.

આ શુભ પ્રસંગે ઉપસ્થિત રાજહંસ ધારાસભ્યશ્રી વિઠ્ઠલભાઈ અમીન દહેગામ અને ધારાસભ્ય શ્રી મણીભાઈ પટેલે, (કપડવંજ) આચાર્યશ્રી કરસનદાસજી મહારાજનું ફુલહારથી સ્વાગત કર્યું હતું. સાથોસાથ આદરણીય ધારાસભ્યો શ્રીનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. ત્યારબાદ સંતો અને મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતાં. સૌ પ્રથમ ધારાસભ્ય શ્રી વિઠ્ઠલભાઈ અમીને પોતાના પ્રવચનમાં જણાવ્યું કે આ શુભ પ્રસંગે સંત સભામાં અમારું સ્વાગત કરવામાં આવ્યું. અમોને " રાજહંસ " કહી બહુમાન કર્યું તેમજ સંતોના દર્શન અને આશીર્વાદનો લાભ મળ્યો તે બદલ આયોજકો અને સંતોનો આભાર વ્યક્ત કર્યો હતો !!

આ પ્રસંગે કપડવંજ ધારાસભ્ય શ્રી મણીભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજકારણમાં ગયેલા નેતાઓ પણ સમાજનું અંગ છે અને સમાજમાંથી જ આવેલા છે. જેથી સમાજને ભૂલી ન જઈ સમાજનાં ઉન્નતિના કાર્યો કરવા પ્રયત્નશીલ રહેવું જોઈએ. અને આચાર્યશ્રીના આશીર્વાદ મારી સાથે જ છે. જેથી સમાજને કલંક લાગે તેવું કોઈ કાર્ય હું કરીશ નહીં. આ પ્રસંગે મને સન્માનિત કર્યો, મને દર્શન–આશીર્વાદનો લાભ મળ્યો તે બદલ આયોજકો અને સંતોનો આભારી છું.

realpatidar.com

https://archive.org/details/bk109/page/n19/mode/1up

realpatidar.com

ત્યારબાદ શ્રી સતપંથ મંદિર ફૈજપુર–M.S.ના મહંત શ્રી જગન્નાથજી મહારાજે વિષ્ણુ ભગવાનના દસ અવતારનું સંક્ષિપ્ત વર્ણન કર્યું હતું હતું. શ્રી ઈમામશાહ મહારાજે માનવતા ધર્મનું પાલન કરવાનું માર્ગદર્શન શિક્ષાપત્રિમાં આપ્યું છે. અને શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાનની ઉપાસના બતાવી છે. "ૐકાર' અને જ્યોતિ સ્વરૂપનું ધ્યાન યુગ પ્રમાણે "ઘટપાટ" ની પૂજાનું વર્ણન કરેલ છે, છેલ્લે સર્વને આશીર્વચન પાઠવ્યા હતા. ત્યારબાદ વનવાસી સંતશ્રી રમણભાઈ ભગતે સતપંથ પ્રેરણાપીઠમાં ગયા વર્ષે સંતસંમેલન થયું તેનું વર્ણન કર્યું. સતપંથના વૃક્ષની ડાળી અને પાંદડાં ઘણાં વિશાળ છે. કારણ કે તેનાં મુળીયાં બહુ ઉંડા છે. નાટક, સિનેમા, ટી. વી. જોવાનાં મૂકીને મંદિરમાં જશો, સાચા સતપંથી બનીને રહેજો અને "હું સતપંથી છું' તેનું ગૌરવ રાખશો" જરાપણ શરમાશો નહીં, ત્યારબાદ શ્રી ઘનશ્યામદાસજી મહારાજે (માતર) જણાવ્યું હતું કે "આજે આ સતપંથની ધર્મ-સભા નિહાળી એક કૌટુંબિક સભા જેવું લાગે છે. આજનો શ્રી નિષ્કલંકી નારાયણ સતપંથ મંદિર પ્રતિષ્ઠાનો મહોત્સવ તે શ્રી ઈમામશાહ દાદાનો પ્રસંગ છે, જેથી કુટુંબનો પ્રસંગ છે. તેમ ચોક્કસ કહી શકાય. મંદિર અને સંત સમાગમથી માણુસ માણુસાઈ મેળવી શકે છે. દારૂડીયો માનસિક શાંતિ માટે વ્યસન કરે છે તેમ આપણે આદર્શ બનવા મનની શાંતિ માટે મંદિરની જરૂર છે. મંદિરમાં જવાનું વ્યસન જરૂર રાખજો. બીજા વ્યસનોથી દૂર રહેજો !!! "મંદિર એ સારા–સંસ્કારી નાગરીક બનાવવાનું કારખાનું છે." મનુષ્યને પશુમાં ફેર કેટલો ? તે વિષે દ્દષ્ટાંત આપ્યું હતું. સારા દેખાવા માટે નહીં સારા બનવા માટે પ્રયત્ન કરવો !!! ભાગવતમાં કલયુગ અને ભગવાન કલ્કી અવતાર ધારણ કરશે તેમ શ્રી ઈમામશાહ મહારાજે પણ કહ્યું છે કે કળયુગ અંતે શ્રી નિષ્કલંકી નારાયણ રૂપે ભગવાન આવશે. ને આશને બિરાજે તે માટે સતત તેનું રટણ કરશો....!!!

ત્યારબાદ શ્રી કૃષ્ણાનંદ સરસ્વતીજી એ જણાવ્યું કે ૧૫માં સૈકામાં શ્રી ઈમામશાહ મહારાજ આવ્યા હતા તે આજે આપણામાં જાગૃતિ લાવવા માટે સ્વરૂપ બદલીને આપણી સમક્ષ આવ્યા છે. જે આચાર્યશ્રી કરસનદાસજી મહારાજ છે. મંદિરની પ્રતિષ્ઠા એટલે તેમાં સંતો તેને વેદોક્ત આધારે પ્રાણ પ્રતિષ્ઠા કરે છે. જેથી તેમાં "પ્રાણ" પુરાય છે. માણુસને મંદિરની જરૂર છે. મંદિર એ મનને ચાર્જ કરવાનું સ્થળ છે. સારાં સંસ્કારોવાળાં મા–બાપ હોય તો સંતો પેદા થાય. માટે સંસ્કારની જરૂર છે. જે સંસ્કાર મેળવવા મંદિરની જરૂર છે. ભગવાનને પ્રસન્ન કરવા માટે ભગવાનના નામમાં ખોવાઈ જાવ, પ્રાર્થના કરો, સંસારને ભૂલી જાવ, એકલીન બનીં જાવ ભગવાન જરૂર પ્રસન્ન થશે. મંદિર એ પરમાત્મા સાથે ટેલીફોન જોડવા માટે એક્ષચેન્જ છે. માટે મંદિરની જરૂર છે. માનવ શરીરમાં અનંત ખજાનો છે. તે ખજાનાની ચાવી મળી જાય તો તેના જેવો કોઈ શ્રીમંત નથી !!! સતપંથી યુવાનો જાગો વિશ્વને સંદેશો આપો સતપંથ સાચું સોનું છે. સાચા સોનાની વિશ્વને જરૂર છે.

અંતમાં પ. પૂ. આચાર્યશ્રી કરસનદાસજી મહારાજે જણાવ્યું હતું કે દિવાળીપુરા–મેત્રાસની જનતા આદીવાસી હોવા છતાં તેમનું શીસ્ત અને આચાર સંહિતા આપણા સૌના માટે પણ ઉદાહરણ રૂપ હતા. આ વર્ષ મંદિરની પ્રતિષ્ઠાનું વર્ષ કહી શકાય. મંદિર એ સંસ્કાર કેન્દ્ર છે. પણ ઘરમાં પોતાનાં મા–બાપ છે તે જીવતાં–જાગતાં મંદિર છે. તેની સેવા કરજો. તેને કોઈ ઘરડા ઘરમાં જવાનો સમય ન આવે તેની કાળજી રાખશો. સુખી, સંસ્કારી, સમૃદ્ધ બની નિરોગી દિર્ઘાયુ પામો તેવા આશીર્વાદ પાઠવ્યા હતા !!! ત્યારબાદ લવાડ ફાર્મ ગામના ઉત્સાહી યુવાન શ્રી અંબાલાલ રવજીભાઈ પટેલે આભારવિધિ કરી આજની સભા વિસર્જન કરી હતી !!!

realpatidar.com

https://archive.org/details/bk109/page/n20/mode/1up

realpatidar.com

(૧) "સતપંથ એર" શોભા યાત્રામાં આચાર્યશ્રીને ચમર ઢળાવવા માટે રૂા. ૧૫,૦૦૧
શ્રી કરસનભાઈ કાનજીભાઈ પટેલ, જલારામ ફાર્મ દહેગામ.

(૨) મંદિરનું પ્રવેશ દ્વાર ખુલ્લુ મુકવા માટે રૂા. ૨૧,૦૦૦/-
શ્રી શાંતિલાલ માવજીભાઈ હે. પટેલ. લવાડ ફાર્મ-દહેગામ.

(૩) શ્રી નિષ્કલંકી નારાયણના સિંહાશનની પધરામણી માટે રૂા. ૩૪,૦૦૦/-
શ્રી રતિભાઈ અરજણભાઈ મુખી-લવાડ ફાર્મ-દહેગામ.

(૪) શ્રી આધ શક્તિ માતાની જયોતિ પ્રાગટ્ય રૂા. ૫૧,૦૦૦/-
સ્વ. શ્રી રવજીભાઈ કરસનભાઈ પટેલ પરીવાર, લવાડ ફાર્મ દહેગામ.

(૫) શ્રી ધર્મ ધજા આરોહણ માટે રૂા. ૪૫૦૦૦/-
શ્રી રામદાસ બાપુ પરીવાર, પંચવટી ફાર્મ દહેગામ.
હસ્તે કાન્તિભાઈ આર. પટેલ. U. S. A.

(૬) શ્રી નિષ્કલંકી નારાયણ મંદિરના શિખરે કળશ આરોહણ રૂા. ૩૭,૦૦૦/-
(૧) શ્રી ધનજીભાઈ કરમશીભાઈ પટેલ, પરીવાર, લવાડ ફાર્મ દહેગામ.

(૭) ત્રિદેવ જ્યોતિ પ્રાગટ્ય, (બ્રહ્મા, વિષ્ણુ, મહેશ) રૂા. ૩૫,૦૦૦/-
શ્રી માધાભાઈ વાલજીભાઈ પટેલ, પરીવાર, જનકપુર-કચ્છ,

(૮) પુજામાં મુખીની ગાદીની સ્થાપના માટે રૂા. ૩૦,૦૦૦/-
શ્રી અરજણભાઈ સવજીભાઈ પટેલ પરીવાર, લવાડફાર્મ-દહેગામ.

(૯) પુજા વિધિના સેવક માટે રૂા. ૨૫,૦૦૦/-
શ્રી ગોવિંદભાઈ ધનજીભાઈ પટેલ પરીવાર, લવાડફાર્મ-દહેગામ.

(૧૦) કળશમાં જળરૂપી વિષ્ણુનું આહ્વાન કરવા માટે રૂા. ૨૪,૦૦૦/-
શ્રી કેશરાબાપાનો પરીવાર, હસ્તે લાલજીભાઈ પટેલ, લવાડફાર્મ-દહેગામ.

(૧૧) દેવોને ફુલહાર વિધિ માટે રૂા. ૨૧,૦૦૦/-
શ્રી શાંતિભાઈ માવજીભાઈ હે. પટેલ, પરીવાર, લવાડફાર્મ-દહેગામ.

(૧૨) સર્વ દેવોની આરતી ઉતારવા માટે રૂા. ૩૧,૦૦૦/-
શ્રી માવજીભાઈ લખુભાઈ પટેલ, વડોદરા લાટ-દહેગામ.

(૧૩) પુજા પ્રસંગે દેવોને ચમર ઢળાવવા માટે રૂા. ૨૧,૦૦૦/-
શ્રી કરસનભાઈ હીરજીભાઈ પટેલ, કોડીકંપા (ઇડર).

(૧૪) શ્રી બ્રહ્માજીને થાળ જમાડવા માટે રૂા. ૨૩,૦૦૦/-
શ્રી શાંતિલાલ શામજીભાઈ ધોળુ-દુર્ગાપુર-કચ્છ.

(૧૫) શ્રી વિષ્ણુ ભગવાનને થાળ જમાડવા માટે રૂા. ૨૧,૦૦૦/-
M/S. શ્રી લક્ષ્મી શ્રાફ ખેડબ્રહ્મા S.K.

realpatidar.com

https://archive.org/details/bk109/page/n21/mode/1up

realpatidar.com

(૧૬) શ્રી મહેશ્વર ભગવાનને થાળ જમાડવા માટે — રૂા. ૨૨,૦૦૦/-
શ્રી ધનસુખભાઈ પટેલ નખત્રાણા-કચ્છ

(૧૭) શ્રી આદ્ય શક્તિને થાળ જમાડવા માટે — રૂા. ૧૮,૦૦૦/-
શ્રી દયારામ ખેતાભાઈ પટેલ નરોડા-અમદાવાદ

(૧૮) સર્વ દેવોને થાળ જમાડવા માટે — રૂા. ૨૨,૦૦૦/-
(૧) શ્રી કરસનભાઇ જીવરાજભાઈ પટેલ રાજેન્દ્ર ફાર્મ દહેગામ
(૨) શ્રી સવદાસભાઈ રામજીભાઇ પટેલ નાંદોલ ફાર્મ ”

(૧૯) નોબત-આરતી વગાડવા માટે — રૂા. ૨૮,૦૦૦/-
શ્રી લખુભાઇ હંસરાજભાઇ પરીવાર, ચાંપલપુર ફાર્મ-દહેગામ

(૨૦) દેવોને ધૂપ લોબાન માટે — રૂા. ૨૬,૦૦૦/-
M/S. જે. કે. ટાઇલ્સ-દહેગામ હસ્તે સવદાસભાઇ પટેલ

(૨૧) દેવોને મુખવાસ માટે — રૂા. ૧૧,૧૧૧/-
શ્રી ગુરૂકૃપા પાટીદાર સંસ્કાર કેન્દ્ર, ગાંધીનગર

ઉપરોક્ત પ્રસંગે ઉપસ્થિત જનસમુદાયને નીચેના દાનવીર તરફથી બ્રહ્મ ભોજન આપવામાં આવ્યું હતું.

તારીખ	સમય	દાતાશ્રી	ગામ
(૧) ૨૨-૪-૯૫	સાંજે	શ્રી સતપંથ સમાજ	લવાડ ફાર્મ-દહેગામ
(૨) ૨૩-૪-૯૫	બપોરે	(૧) રતિલાલ જીવરાજભાઈ પટેલ	લવાડ ફાર્મ-દહેગામ
		(૨) ધનજીભાઇ કરમશીભાઈ પટેલ	” ” ”

આ શુભ પ્રસંગે શ્રી નિષ્કલંકી નારાયણ મંદિરમાં આરતી માટે આધુનિક ઇલેકટ્રીક નોબત-નગારૂ દાતા શ્રી વિરમદાસ ખીમજીભાઈ પટેલ, હરીપુરા, તા. બાયડ S.K. તરફથી સપ્રેમ ભેટ આપવામાં આવ્યું. ધન્યવાદ !!!

શ્રી નિષ્કલંકી નારાયણ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે સહયોગી દાતાઓ

(૧) શ્રી સતપંથ પ્રેરણાપીઠ પીરાણા, આચાર્યશ્રી કરસનદાસજી મહારાજ ૨૫,૦૦૦/-

(૨) શ્રી રવિલાલ કે. પટેલ વડોદરા — રૂા. ૧૧,૦૦૦/-

(૩) M/s. ગુરૂકૃપા કન્ટ્રકશન કંપની — રૂા. ૫,૧૧૧/-
હ. ગોવિંદભાઈ કે. પટેલ, દુર્ગાપુર-કચ્છ.

(૪) M/s. જનતા કવોરી વર્કસ, વડાગામ. — રૂા. ૫૦૦૧/-

realpatidar.com

https://archive.org/details/bk109/page/n22/mode/1up

realpatidar.com

(૫) માવજીભાઈ ખીમજીભાઈ પટેલ, હરીપુરા, તા. બાયડ,	રૂા. ૫૦૦૧/-
(૬) શ્રી મહિલા સતપંથ સંસ્કાર કેન્દ્ર, લવાડફાર્મ,	રૂા. ૧૫૦૧/-
(૭) શ્રી ડાયાભાઈ માવજીભાઈ પટેલ, મહાકાળી ફાર્મ-દહેગામ	રૂા. ૫૦૦૧/-
(૮) શ્રી સતપંથ સમાજ, નાંદોલ ફાર્મ-દહેગામ	રૂા. ૨૦૦૧/-
(૯) શ્રી નાયાકાકા સતપંથ મંદિર, કુકસ, જી. વડોદરા, હ. આચાર્યશ્રી સવગણુદાસજી મહારાજ	રૂા. ૧૦૦૧/-
(૧૦) શ્રી નિષ્કલંકી નારાયણ સતપંથ મંદિર, દિવાળીપુરા, જી. વડોદરા હ. શ્રી સોમદાસજી મહારાજ	રૂા. ૫૦૧/-
(૧૧) શ્રી યુવક મંડળ લવાડ ફાર્મ દહેગામ	રૂા. ૧૧૦૧/-
(૧૨) શ્રી શામજીભાઈ માવજીભાઈ પટેલ નવજીવન ફાર્મ દહેગામ	રૂા. ૧૦૦૧/-
(૧૩) શ્રી પ્રેમજીભાઈ અખેરામભાઈ પટેલ ત્રિવેણી ફાર્મ દહેગામ	રૂા. ૧૦૦૧/-
(૧૪) શ્રી બળદેવસિંહ બિહોલા વાસણા રાઠોડ દહેગામ	રૂા. ૫૦૧/-
(૧૫) શ્રી વિસાભાઈ ચેલાભાઈ દેસાઈ દહેગામ	રૂા. ૫૦૧/-

ઉપરોક્ત દાતાઓ તેમજ નામી અનામી અનેક દાનવીરોએ દાનની અવિરત ગંગા વહેવડાવી સહયોગી બન્યા હતા, તે બદલ ધન્યવાદ !!!

–ભજન–

–કુ. નયના જયંતિલાલ પટેલ
જામરેલા (ઈડર)

(રાગ– ધુણી રે ધખાવી બેલી)

લાગી રે લગની મને શ્રી નિષ્કલંકીના નામની
શ્રી નિષ્કલંકીના નામની ને પીરાણા ધામની રે...લાગી....
કરવું ગમે ના બીજુ કામ મુજને
ધુન લગાવું શ્રી નિષ્કલંકીના નામની રે...લાગી....
વારી વારી વારણાં લઉં તમારા
જપુ માળા તમારા નામની રે...લાગી...
બુદ્ધિ હીણાં અમે છીએ માનવી.
વાટ (વાત) બતાવે સારા જ્ઞાનની રે...લાગી...
સારા નરસાને ગુરૂ તમે જાણો
લગની લાગી છે તારા નામની રે,
અજાણુતા નથી તારે કોઈ ભકત રે....લાગી....
ભવસાગર છે આ ભારી ભયંકર,
ઉગારજો ભવસાગર પાર રે...લાગી....
આ બાળા નમારા ચરણો પખાળે,
રાખજો તમારા ચરણમાં રે....લાગી....

realpatidar.com

https://archive.org/details/bk109/page/n23/mode/1up

realpatidar.com

શ્રી સતપંથ બાલ–બાલિકા સુસંસ્કાર શિબીર તમારા દ્વારે

(૧) ગ્રામ્ય વિસ્તારનું સમયપત્રક ૧૯૯૫ (ગુજરાત વિભાગ)

સામજીભાઈ કે. પટેલ
મુ. પો. પ્રેરણાપીઠ, પીરાણા.
તા. દસક્રોઈ, જી. અમદાવાદ.

ક્રમ	તારીખ	સમય	ગામ
૧	૪–૫	સ. ૪ થી ૨	વૈદકંપા, પ્રેમનગર, વડાગામ
૨	૪–૫	બ. ૩ „ ૧૦	વજેપુરા
૩	૫–૫	સ. ૪ „ ૨	ધર્મેડાકંપા, ઝવેરીકંપા
૪	૫–૫	બ. ૩ „ ૧૦	હરીપુરા
૫	૬–૫	સ. ૪ „ ૨	લાલુંકંપા
૬	૬–૫	બ. ૩ „ ૧૦	ગઢકંપા, બાડેરાકંપા, મોતીવિણી, સતનગર, રામાપીર, બીબીપુરા, અમરાપુર, અલવાકંપા, હીરાપુર
૭	૭–૫	સ. ૪ „ ૨	ધનસુરા, સિક્કા, બુટાલ
૮	૭–૫	બ. ૩ „ ૧૦	માધવકંપા, મથુરકંપા, બાયડ
૯	૮–૫	સ. ૪ „ ૨	દેસાઈપુરા; લક્ષ્મીપુરા
૧૦	૮–૫	બ. ૩ „ ૧૦	રામપુરા, મેઘપુરા, થરીલાટ
૧૧	૯–૫	સ. ૪ „ ૨	વિષ્ણુપુરા, થવાદ, મોતીપુરા (લાલજીપુરા)
૧૨	૯–૫	બ. ૩ „ ૧૦	કાપડીનીવાવ, કનીજલાટ, ગોઠાજ, વિઠ્ઠલપુરા, સુખપુરા, અમીનપુરા
૧૩	૧૦–૫	સ. ૪ „ ૨	શીવપુરાલાટ, પીરાણાલાટ, હેમપુરીલાટ, ગત્રાડલાટ, આઠીયા લાટ, અમદાવાદ
૧૪	૧૦–૫	બ. ૩ „ ૧૦	પાલડીલાટ, નવસારીલાટ, ઉમીયા ફાર્મ
૧૫	૧૧–૫	સ. ૪ „ ૨	દહેગામ, પંચવટી ફાર્મ, પોકાર ફાર્મ, ગણેશ ફાર્મ, કૈલાસ ફાર્મ, નુતન ફાર્મ. મણીનગર ફાર્મ, ઘોડા ફાર્મ
૧૬	૧૧–૫	બ. ૩ „ ૧૦	લક્ષ્મીનારાયણ ફાર્મ, નાદોલ ફાર્મ, વડોદરા લાટ, નવજીવન ફાર્મ
૧૭	૧૨–૫	સ. ૪ „ ૨	લવાડ ફાર્મ, ચાંપલપુર ફાર્મ, રાણી ફાર્મ, રાજેન્દ્ર ફાર્મ
૧૮	૧૨–૫	બ. ૩ „ ૧૦	સુર્યનગર ફાર્મ, મહાકાળી ફાર્મ, જીયાપર ફાર્મ, ત્રિવેણી ફાર્મ
૧૯	૧૩–૫	સ. ૪ „ ૨	આનંદપુરા, મોડાસા
૨૦	૧૩–૫	બ. ૩ „ ૧૦	નહેરુકંપા, ડોકટરકંપા, કૃષ્ણપુરાકંપા
૨૧	૧૪–૫	સ. ૪ „ ૨	વાવકંપા, ફેકટરીકંપા, શીવરાજપુરા
૨૨	૧૪–૫	બ. ૩ „ ૧૦	જાઝકંપા, માળકંપા, જોગીવંટા

realpatidar.com

https://archive.org/details/bk109/page/n24/mode/1up

realpatidar.com

૨૩	૧૫-૫	સ. ૪	,,	૨	ગાજણકંપા, મણીપુરા. ગણેશપુરા, શેરાપુર, રાજલીકંપા
૨૪	૧૫-૫	બ. ૩	,,	૧૦	નાંદિસણ, ખિલોડા, લીભોઇકંપા, ગઢડાકંપા, ઉમિયાનગર
૨૫	૧૬-૫	સ. ૪	,,	૨	મહાપુર, મોહનપુરા, કેશરપુરા
૨૬	૧૬-૫	બ. ૩	,,	૧૦	લાલપુરા, સબલપુર. મહાદેવપુરા
૨૭	૧૭-૫	સ. ૪	,,	૨	ભવાનીપુરા, દેસાઇપુરા, રામપુરા. રામેશ્વરકંપા (મોડાસા)
૨૮	૧૭-૫	બ. ૩	,,	૧૦	કરસનપુરા, સુખપુરા (મોડાસા), રવિપુરા,
૨૯	૧૯-૫	સ. ૪	,,	૨	નારણપુરા, નવાનારણપુરા (મોડાસા)
૩૦	૧૮-૫	બ. ૩	,,	૧૦	અમરગઢ, જસવંતપુરા, લહેરીપુરા, શીવપુરા (મોડાસા)
૩૧	૧૯-૫	સ. ૪	,,	૨	માઢવા, ધનપુરા, તખતગઢ, રામપુરા, વિલાસપુરા (તા. પ્રાંતિજ)
૩૨	૧૯-૫	બ. ૩	,,	૧૦	કાંકરોલ, નવારામપુરા, જામરેલા, જેતપુર, ઇડર,
૩૩	૨૦-૫	સ. ૪	,,	૨	વડાલીકંપા, કંજલીકંપા
૩૪	૨૦-૫	બ. ૩	,,	૧૦	નારાયણનગર, કમુસણી,
૩૫	૨૧-૫	સ. ૪	,,	૨	મહોરકંપા, વરતોલ, હરણાકંપા
૩૬	૨૧-૫	બ. ૩	,,	૧૦	બડોલકંપા, ખરેડીયાકંપા. વીંછીકંપા વેડાકંપા, વેરાબરકંપા.
૩૭	૨૨-૫	સ. ૪	,,	૨	લક્ષ્મણપુરાકંપા
૩૮	૨૨-૫	બ. ૩	,,	૧૦	હાથરવા, માલપુર
૩૯	૨૩-૫	સ. ૪	,,	૨	કોઠીકંપા, રામેશ્વરકંપા, કુબાધરોલ
૪૦	૨૩-૫	બ. ૩	,,	૧૦	ધનાલકંપા, દેલવાડા
૪૧	૨૪-૫	સ. ૪	,,	૨	ગોતાકંપા, ગાડુકંપા
૪૨	૨૪-૫	બ. ૩	,,	૧૦	વાસણાકંપા, સીંગલકંપા
૪૩	૨૫-૫	સ. ૪	,,	૨	ખેડબ્રહ્મા, માતાજીકંપા
૪૪	૨૫-૫	બ. ૩	,,	૧૦	મેત્રાલકંપા, જગમેરકંપા, બારસોલ
૪૫	૨૬-૫	સ. ૪	,,	૨	લક્ષ્મીપુરા, સીલવાડા, સંગ્રામપુરા, દિધિયાકંપા, ખેરગઢ
૪૬	૨૬-૫	બ. ૩	,,	૧૦	તાંદલિયા, કલોલકંપા
૪૭	૨૭-૫	સ. ૪	,,	૨	દામાવાસ
૪૮	૨૭-૫	બ. ૩	,,	૧૦	રવિપુરા, જુનામેઘ
૪૯	૨૮-૫	સ. ૪	,,	૨	ખેરાસણ, ધોળીવાવ, ડુંગરીકંપા
૫૦	૨૮-૫	બ. ૩	,,	૧૦	પ્રતાપગઢ, ઈશ્વરપુરા, પંચવટી
૫૧	૩૦-૫	૯	,,	૫	નાણાં ફાર્મ, અજારી ફાર્મ, ચાણોદ ફાર્મ
૫૨	૧-૬	૯	,,	૫	કામલપુર, જી. રાધનપુર

ઉપરના સમયમાં એકથી વધારે ગામો લખેલાં છે. તે સંયુક્ત ગામોના આગેવાન ભાઇઓ ભેગા મળી એક ગામમાં વ્યવસ્થા ગોઠવી.

નોંધ : શિબિરાર્થીઓની સમીક્ષા અને ભાવી કાર્યક્રમો માટે વાલીઓ સાથે વિચારણા કરવા અને શિબિરાર્થીઓની (શિબિર સુ-સંસ્કાર મંડળ) રચના કરવા બાબતે ગ્રામ્ય વિસ્તારની

realpatidar.com

https://archive.org/details/bk109/page/n25/mode/1up

realpatidar.com

મુલાકાતનું સમયપત્રક ઉપર મુજબ છે. કદાચ સમય અનુકુળ ન હોય તો શિબિરાથીઁઓના દાદા શામજીભાઈ કાનજીભાઈ વૈદકંપાને રૂબરૂ મળી ફેરફારનો સમયપત્રક અચુક લઈ જશો.

ઉપરોક્ત કાર્યમાં સ્વાગતની આવશ્યક્તા નથી. શિબીર બાળકોના દ્વારે હોઈ અમે આપના ગામમાં આપ સૌના દર્શન કરવા માટે આપની પાવન ભૂમિની રજમાં આળોટવા આવીએ છીએ તો વાલીઓ તેમજ શિબીરાથીઁઓને નમ્ર સુચન કે 'ફૂલહાર' કે 'ભેટથી' સ્વાગત કરવાનો આગ્રહ રાખવો નહીં, સ્વાગત આવકાર્યનથી. આપ સૌ વાલીઓ અને શિબીરાથીઁઓ સાથ સહકાર આપી આપણા કાર્યને સફળ બનાવશો એજ અમારૂ 'સ્વાગત' છે.

લી. શિબિરાથીઁના 'દાદા'
શામજીભાઈ કે. પટેલ
મુ. પો. પ્રેરણાપીઠ પીરાણા.
તા. દસક્રોઈ, જી. અમદાવાદ.

તા. ક. : આપના ગામમાં આપેલ સમયે શિબિરાથીઁઓ તથા વાલીઓએ ઉપસ્થિત રહેવું.

સવારનો કાર્યક્રમ

સમય	વિગત
૪-૩૦ થી ૫-૩૦	દેવ દર્શન – સંધ્યા આરતી
૫-૩૦ થી ૬-૦૦	ચા – દુધ સાથે રોટલી
૬-૦૦ થી ૯-૦૦	વાલીઓ અને શિબીરાથીઁઓની સંયુક્ત સભા.
૯-૦૦ થી ૧૦-૦૦	શિબીરાથીઁઓની પ્રાઇવેટ મુલાકાત સભા
૧૦-૦૦ થી ૧૧-૦૦	વાલીઓની પ્રાઇવેટ મુલાકાત સભા
૧૧-૦૦ થી ૧૨-૦૦	ભોજન [જમણમાં રોટલી, શાક] [ફક્ત મહેમાનો માટે]
૧૨-૦૦ થી ૨-૦૦	આરામ
૨-૦૦ થી ૨-૩૦	વિદાયગીરી

બપોર પછીનો કાર્યક્રમ

૩-૦૦ થી ૬-૦૦	વાલીઓ અને શિબીરાથીઁઓની સંયુક્ત સભા
૬-૦૦ થી ૬-૩૦	રીશેષ
૬-૩૦ થી ૭-૦૦	ભોજન [ખીચડી, કઢી, રોટલી] [ફક્ત મહેમાનો માટે]
૭-૦૦ થી ૮-૦૦	દેવ દર્શન, સંધ્યા-આરતી
૮-૦૦ થી ૯-૦૦	શિબીરાથીઁઓની પ્રાઇવેટ મુલાકાત સભા
૯-૦૦ થી ૧૦-૦૦	વાલીઓની પ્રાઇવેટ મુલાકાત સભા
૧૦-૦૦ થી ૧૦-૩૦	[રાત્રે] વિદાયગીરી

realpatidar.com

https://archive.org/details/bk109/page/n26/mode/1up

realpatidar.com

બાળ શિબીરાર્થીઓ માટે વેકેશન વિઝીટ કાર્યક્રમ

* ઉપરોક્ત કાર્યક્રમમાં સામજીબાપા સાથે ઉત્સાહી સક્રિય કાર્યકરો ૬ (છ) કુલ ૭ (સાત) જણ રહેશે.

શિબીરાર્થીઓના વાલીઓ સાથે ચર્ચા

* આપણા બાળકો માટે કેવા કાર્યક્રમો ગોઠવીએ તો બાળકોના ભવિષ્ય ઉજ્વળ બને, તે માટે વાલીઓ સાથે ચર્ચા વિચારણા કરવી.
* વાલીઓ પોતાના બાળકો માટે શું કરી શકે તેમ છે અને શું કરવું જોઈએ તેની ચર્ચા વિચારણા
* આપણા બાળકોએ શુસંસ્કાર સાથે શિક્ષણ મેળવ્યું હશે, તો વધુ પ્રમાણમાં કોને ફાયદો થશે તે વિષે ચર્ચા વિચારણા.
* બાળકોને બાળ શિક્ષણ સીબીરના માધ્યમ દ્વારા સુસંસ્કાર આપવાનો હેતુ શું છે. તે વિશે ચર્ચા વિચારણા કરવી.
* બાળ શિક્ષણ સીબીરો શા માટે ? સીબીરોથી આપણા બાળકોમાં કેટલા અંશે પરિવર્તન આવ્યુ છે. તે અંગે વાલી વડીલોના મંતવ્યો લેવા.
* વેકેશન વિઝીટ કાર્યક્રમ દરમ્યાન દરેક ગામમાં ઉત્સાહી વડીલોને બાળ શીબીરાર્થીઓ પ્રત્યે અંગત રસ લઇ જરૂરી માર્ગદર્શન આપવું તેના માટે વડીલોને માહીતી આપવી.
* 'સતપંથ જ્યોત' માસિક અંક કેટલા સતપંથી મિત્રો નિયમિત વાંચે છે. તે અંગે પુછવું બાદ 'સતપંથ જ્યોત' અંકના ફાયદા તથા તે વિષે નાના મોટા દરેકના મંતવ્યો લેવા.
* શિબીરાર્થીઓ તથા વાલીઓ સાથે અલગ અલગ ચર્ચાઓ કરી દરેકનાં મંતવ્યો લેવાં, છેલ્લે સમુહ બેઠક કરી કાર્યક્રમ સમાપ્ત કરવો.

વેકેશન વિઝીટ કાર્યક્રમ દરમ્યાન શિબિરાર્થીઓ સાથે ચર્ચા

* શિબિરાર્થીઓ એજ શિબિર માંથી મેળવેલ જ્ઞાન અને સંસ્કાર ના સિંચનથી સમાજ અને સતપંથ સંપ્રદાયમાં અદ્ભુત ક્રાંતિ લાવવાની છે. તો તેવી ક્રાંતિ લાવવા માટે આપણે કેવા કેવા કાર્યક્રમો યોજવા તે બાબતે ચર્ચા કરવી...શિબિરાર્થીઓનાં મંતવ્યો લેવાં,
* સતપંથ સુસંસ્કાર શિબિરો યોજવાનાં કારણો અને હેતુઓની છણાવટથી શિબિરાર્થીઓને જાણ કરવી.
* સ્વ. સંચાલીત સતપંથ બાળ શિક્ષણ શિબિરના ભાવી કાર્યક્રમો યોજવા માટે તેજસ્વી શિબિરાર્થીઓની નોંધ કરવી તેવા તેજસ્વી શિબિરાર્થીઓની એક બેઠક પીરાણા અથવા વૈદકંપા ગોઠવવી.

realpatidar.com

https://archive.org/details/bk109/page/n27/mode/1up

realpatidar.com

* શિબિરાર્થીઓના જન્મદાતા શ્રી શામજીબાપા તેમજ શિબિરના હીતેચ્છુઓએ બાળકોને જાણ કરવી. તેમની સાથે કાયમ સંબંધો જાળવી રાખવા સુચન કરવું યોગ્ય માર્ગ દર્શન માટે પુછપરછ કરવી અને સંપર્કમાં રહેવું.

* સતપંથ સંપ્રદાયના કોઇ પણ સ્થળે યોજાતા કોઈ પણ ધાર્મિક કાર્યક્રમ (જેવા કે, મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, દશ અવતાર કથા રસપાન કાર્યક્રમ, પીરાણા શુભ સ્થળે યોજાતા કાર્યક્રમો વિ. માં શિબિરાર્થીઓએ સહકારની ભાવનાથી ભાગ લેવા માટેની સમજ આપવી. અને ઉત્સાહી શિબિરાર્થીઓને કાર્યક્રમમાં અચુક સામેલ રાખવા. શિબિરાર્થીઓને સભા મંડપમાં બેઠક અલગ વ્યવસ્થા કરવી, શિબિરાર્થીઓથી થઈ શકે તેવા કાર્યક્રમોમાં સેવા આપે.

* અને સમાજમાં આગળ આવે બાળ શિબિરાર્થીઓની ઓળખ માટે જુદા પ્રકારના બિલ્લા બનાવવા અને તે બિલ્લાનો ઉપયોગ આવા ધાર્મિક અને સામાજીક કાર્યમાં જ ઉપયોગ કરવો.

* ગત વર્ષોમાં યોજાયેલ બાળશિક્ષણ શિબિરમાં શિબિરાર્થીઓએ અભ્યાસ ક્રમની બંન્ને પુસ્તીકાઓ (નિત્ય પાઠ–વિચનામૃત બિંદુ)માંના મંત્રો, ગુરૂવંદના, આરતી, સદ્ગુરની શિખામણ, વગેરે કંઠસ્થ કરેલાં હતાં તેવા મંત્રો, વિ. ફક્ત કંઠસ્થ કરવું પુરતુ નથી પણ તેને વાસ્તવિક જીવનમાં ઉતારી અમલ કરવા સમજ આપવી. ઉપરોક્ત મંત્રો, શ્લોકો વગેરે માંથી ભુલી ગયા છે કે બરાબર કંઠસ્થ છે તેની સમિક્ષા કરવી.

* શ્રી સતપંથ પ્રેરણા પીઠ, પીરાણાથી પ્રગટ થતું "સતપંથ જ્યોત" નામનું માસિક મુખ પત્રના ફાયદા, મંતવ્યો વિષે ચર્ચા કરવી. "સતપંથ જ્યોત" અંક દરેક દરેક બાળક વાંચે તેવી સમજ આપવી.

* દરેક શિબિરાર્થીઓએ પાંચ શિબિરમાં ભાગ લેવાનું રહેશે. પાંચ શિબિરો માંથી મેળવેલ જ્ઞાન અને સુસંસ્કારો વાળા તેજસ્વી શિબિરાર્થી બાળ–બાલિકાઓએ જો શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચ ગુણવત્તા મેળવી સ્નાતક બન્યા હશે તેમને આપણા સતપંથ સમાજ તરફથી ભવિષ્યમાં શરૂ થનારી, બેંકો ગુરૂકુળો, હોસ્પીટલો વિ.માં તેની યોગ્યતા પ્રમાણે નોકરીએ લેવામાં આવશે. તેમજ શિબિરના તેજસ્વી શિબિરાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવા આર્થિક સહયોગ મળશે.

* દરેક ગામોમાં શિબિરાર્થી બાળાઓ માટે H. S. C. (બારમુ), અથવા સ્નાતક બહેન તેજ ગામમાંથી સુસંસ્કારનો અભ્યાસ આગળ વધારવા માટે ગામદીઠ, એક બહેનની નિમણુંક કરવી. તેજ રીતે બાળ મિત્રો માટે એક ભાઈની નિમણુંક કરવી. તેઓએ સંસ્થા તરફથી મળેલ સુચનો મુજબ શિબિરાર્થીઓનું સંચાલન કરવાનું રહેશે.

* "પરમ વિશિષ્ઠ તેજસ્વી" શિબિરાર્થીઓ (બાલ–બાલિકા) ને વર્ષમાં એક વખત હેતુલક્ષી પ્રવાસનું આયોજન કરવું.

realpatidar.com

https://archive.org/details/bk109/page/n28/mode/1up

realpatidar.com

યુવાન વર્ગ માટે :

* સતપંથ સંપ્રદાયના યુવાનો સાથે સામાજીક અને ધાર્મિક વિકાસ માટેનાં કેટલાંક સુચનો અને મંતવ્યો માટે ચર્ચા કરવી...તેમજ સામાજીક ઉન્નતીનાં કાર્યો કરવાં જેવાં કે, રચનાત્મક, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરવા તાલુકા દીઠ કારોબારીના સભ્યોનાં નામ નોંધવાં કારોબારીને કરવાનાં કાર્યોનાં સુચનોનો નોંધ કરાવવો. દા.ત. "સતપંથ પરિવાર"નું આયોજન કરી કાર્યક્રમ બનાવો.

* યુવાન વર્ગની "યુવા શિબિર" અથવા "યુવરાજ શિબિર" માટેનાં સુચનોની નોંધ કરવી. "યુવા શિબિર" માટે વય મર્યાદા ઉ. વર્ષ ૨૦ થી ૪૫ વર્ષ સુધીની રહેશે.

✻ શિબિરાર્થીના દ્વારે ✻

અન.	તારીખ	સેવામાં ભાગ લેનાર
૧.	૪-૫-૯૫ થી ૧૧-૫-૯૫	શ્રી સુરેશકુમાર સવજીભાઈ પટેલ મુ. તાંદલીયા, પો. દામાવાસ તા. ખેડબ્રહ્મા, જી. સા. કાં. ફોન નં. ૦૨૭૭૫ ૮૧૩૬૧
૨.	૧૩-૫-૯૫ થી ૨૦-૫-૯૫	શ્રી શાંતિલાલ જીવરામભાઈ પટેલ મુ. નવા રામપુરા પો. વડાલી તા. ઈડર જી. સા. કાં. ફોન ૦૨૭૭૮ ૨૩૬૬
૩.	૨૧-૫-૯૫ થી ૨૮-૫-૯૫	શ્રી પ્રફુલ્લચંદ્ર કાંતિલાલ પટેલ મુ. તાંદલીયા પો. દામાવાસ, તા. ખેડબ્રહ્મા જી. સા. કા. ફોન ૦૨૭૭૫ ૮૧૩૪૮
૪.	૨૯-૫-૯૫ થી ૬-૬-૯૫	શ્રી નરેશકુમાર રતિલાલ પટેલ મુ. નારાયણ નગર પો. ડોભાડા તા. ઈડર જી. સા. કાં. ફોન નં. ૦૨૭૭૮ ૮૫૩૩૧
૫.	૭-૬-૯૫ થી ૧૩-૬-૯૫	શ્રી સુરેશકુમાર શામળદાસ પટેલ મુ. તાંદલીયા પો. દામાવાસ તા. ખેડબ્રહ્મા જી. સા. કા. ફોન નં. ૦૨૭૭૫ ૮૧૩૭૮

realpatidar.com

https://archive.org/details/bk109/page/n29/mode/1up

realpatidar.com

ધાર્મિકતા સામે દાંભિકતા

—નરેશ વી. પોકાર ધોળીવાવ-વિજયનગર

વર્તમાન યુગમાં મોટાભાગના લોકો ભયથી કે ઇચ્છાઓની અપેક્ષાથી ધર્મનો આશ્રય લેતા હોય છે. અને દીવો, અગરબત્તી, પુજા-પાઠ, દર્શન-કથા વગેરે દ્વારા પોતાની જાતને ધાર્મિકતા ગણાવતા હોય છે. પરંતુ બીજીબાજુ કામચોરી, ભ્રષ્ટાચાર અને દહેજ વગેરે કાર્યો દ્વારા પોતાનો સ્વાર્થ સિદ્ધ કરતા હોય છે.

ધર્મનું આવું વિકૃત સ્વરૂપ તો વિશ્વના કોઈ પણ ધર્મગ્રંથોમાં દર્શાવેલ નથી લોકો એ ધર્મને પોતાના જીવનથી અલગ કરી નાખ્યો. પરંતુ મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે ધર્મને તમે અલગ કેવી રીતે કરી શકો? તે તો લોહીના સાથે ભળેલો છે. લોકોએ ધર્મને માત્ર દેવસ્થાન પૂરતો મર્યાદીત જ રાખ્યો અને પોતાના સ્વાર્થને સિદ્ધ કરવા માટે જે કાંઈ કરવું પડે તે બીજાના ભોગે પણ કરવાનું ચાલું રાખ્યું પરંતુ આ ધાર્મિકતા નથી નરી દાંભિકતા જ છે. ધાર્મિકતા માણસને તારે પરંતુ દાંભિકતા ડૂબાડે.

શાસ્ત્રકારોએ ધર્મની વ્યાખ્યા આપતા કહ્યું છે કે ધૃ ધારયતિ ઈતિ ધર્મ, જે જીવનને ધારણ કરી રાખે છે. ટકાવી રાખે છે તેજ ધર્મ છે. ધર્મ તો માણસ માણસની વચ્ચે સેતુ બને છે અને જોડવાનું કાર્ય કરે છે તોડવાનું નહિ.

ધર્મ માણસના હૃદયમાં દયા, પ્રેમ, કરુણા, અહિંસા અને શાંતિને જન્મ આપે છે અને સર્વ પ્રત્યે સમભાવ ઉત્પન્ન કરે છે. જેનામાં આ ગુણો ખીલ્યા છે એ જ ધાર્મિક છે. ધર્મનું મુળ સ્વરૂપ ક્રિયાત્મ કરતા ભાવનાત્મક વિશેશ છે અને જે બાહ્ય ક્રિયાકાંડ છે. એ પણ અંદરના ભાવને જાગૃત કરવા માટે જ છે.

એને પણ માં છે....છોડી મૂકો

ઘોર અંધારી રાત હતી ...યુદ્ધમાંથી ભટકતો થયેલ અશ્વત્થામા આમ તેમ ભટકતો હતો, પાંડવો પ્રત્યેનો દ્વેષભાવ ઓછો થયો ન હતો બલ્કે વધતો જ ગયો હતો. અશ્વત્થામા વિચારતો બેઠો હતો અને એ જ સમયે એક દૃશ્ય જોયું. એક ઘુવડ ધીરે રહી કાગડીના માળામાં પેસી ગયું. કાગડાનાં બચ્ચાંને મારી નાખ્યાં.

અશ્વત્થામાના મનમાં પાપી વિચાર આવ્યો, હું પણ આજ રીતે પાંડવ છાવણીમાં ઘુસી દ્રૌપદીના પુત્રોને મારી નાખું તો પાંડવો નિર્વંશ થાય. જીતની બાજી હારમાં ફેરવાઈ જાય.

એ રાતે એ શેતાની ખેલ ભજવાઇ ગયો. અશ્વસ્થામાએ દ્રૌપદી પુત્રોનો વધ કર્યો અને નાશી ગયો. સવાર થતાં જ કાગારોળ થઈ રહી. દ્રૌપદી હૈયાફાટ રડવા માંડી, એ મા હતી. એના પુત્રો મરાયા હતા, અર્જુનથી આ જોવાયું નહિ, એણે અશ્વત્થામાને પકડી લાવવાની પ્રતિજ્ઞા કરી અશ્વત્થામાને પકડી અર્જુને દ્રૌપદી સમક્ષ હાજર કર્યો તો દ્રૌપદી રડતી રડતી બોલી ઉઠી...."આને છોડી મૂકો. તમે ગુસ્સે થશો તો એને મારી નાખશો અરે....એને પણ મા છે અને એને બિચારીને મારી જેમ રડવાનો વારો આવશે....ના....ના....આવું થાય એ પહેલાં એને છોડી મૂકો...."

સંકલન- મધુ અમદાવાદ

realpatidar.com

realpatidar.com

નહિ આવે કંઈ સાથે

-સુરેશ. ડી. પટેલ.
હનુમાન કંપા S. K.

આ સૃષ્ટિ બહુ વિશાળ છે. તેની અંદર ઘણી જાતનાં પ્રાણીઓ રહે છે. તેમાનું માનવી પણ એક પ્રાણી છે. તે વિશિષ્ટ બુદ્ધિ અને જ્ઞાન ધરાવતું પ્રાણી છે. તેથી બધા પ્રાણીઓ કરતાં વિશિષ્ટ ગણાય છે.

માનવી ભલે વિશિષ્ટ છે. પરંતુ તેમાં કેટલાક અવગુણો છે. માનવી ધન–દૌલતની પાછળ પડી ગયો છે. ધન–દૌલત તેના માટે સર્વસ્વ છે. તેવું માને છે.

એક ગામ હતું ગામની અંદર એક ધનવાન શેઠ રહેતા હતા. તે બહું જ કંજુસ વૃતિના હતા. એક પૈસો પણ સારા કાર્યની અંદર કે ધર્મના કામની અંદર ન આપતા. શેઠની પત્ની મૃત્યુ પામી હતી, શેઠનો છોકરો ઉમંર લાયક થયો શેઠે તેને પરણાવ્યો. શેઠના દિકરાની પત્ની ઉદાર હતી. તેને જાણ્યું કે મારા સસરો કંજૂસ છે. આમ કરતાં કરતાં ઘણા દિવસો વિતી ગયા. શ્રાવણ મહીનો આવ્યો. ગામમાંથી પગપાળા યાત્રા કરવા કેટલાંક લોકો જવાના હતા.

શેઠને પણ યાત્રાએ આવવા કહ્યું પણ શેઠે તો ના પાડી પરંતુ તેના દિકરાની પત્નીએ તથા સબંધી એ સમજાવી કહ્યું કે પગપાળા યાત્રા છે. તેથી ઘણો ખર્ચો થશે નહી આમ ઘણો આગ્રહ કરવાથી શેઠ યાત્રાએ જવા તૈયાર થયા.

શેઠે તેની પુત્ર વધુને કહ્યું કે આપણા ઘરમાંથી પૈસા ન જવા જોઈએ. તેનું ધ્યાન રાખજો એમ કહી સમજાવી તેને તીજોરીની ચાવી સોપી યાત્રાએ જવા નીકળ્યા.

શેઠ યાત્રા ગયા પછી તેની પુત્ર વધુએ તેના પતિને સમજાવ્યું કે પિતાજીએ પૈસા ભેગા કર્યા છે. અને દાન-પુન્ય કર્યું નથી. એમ સમજાવી. તેને કહ્યું કે પિતાજી યાત્રાએ ગયા છે, તેથી આપણે દાન-પુન્ય કરીએ. પતિ પણ તેની સાથે સમંત થયો આમ પતિ-પત્નિ બંને વિચાર કરીને આજુબાજુ ગામના બ્રાહ્મણો, અનાથ, ગરીબને જમાડવાનું અને વસ્ત્રનું દાન આપવાનું નક્કી કર્યું બીજે દિવસથી જ સર્વેને જમવા કહ્યું. આમ એક મહીના સુધી ગરીબોને જમાડયાં પછી વસ્ત્ર વગેરે આપી ખુશી કર્યા.....

આ બાજુ હવે શેઠની યાત્રા પુરી થઈ તેથી તે આવ્યા. ગામમાં આવતાં શેઠને જાણવા મળ્યું આ ગરીબો, બ્રાહ્મણો અને અનાથો પોતાના ઘેરથી જમીને આવે છે. તેથી શેઠ દોડતાં-દોડતાં ઘરે ગયા. અને ગુસ્સે થઈને કહેવા લાગ્યા કે વહું મે તમને કહ્યું હતું કે આ ઘર તમારું તમારે સાચવવાનું છે. અને તમે તો બધુ દાનમાં આપવાં માડયું મારી આખી જિંદગીની કમાઈ વેડફી નાખી પોતાના દિકરો અને વહુએ જ પૈસા લૂંટાવી નાખ્યાં તો શું કરું. ? એમ નિશાશો નાખવા લાગ્યા.

એક દિવસ શેઠ બેઠાં હતાં ત્યારે તેની પુત્ર વધુએ કહ્યું "પિતાજી મારા પિતાજીએ સ્વર્ગ-માંથી કહ્યું છે કે તેમના ચંપલનો આગળનો દટ્ટો તૂટી ગયો છે. તો આપ જ્યારે જાવ ત્યારે મારા પિતાજી માટે દટ્ટો સાધવા સોય લેતાં જજો" આમ પુત્ર વધુનું બોલવું સાંભળી શેઠ વિચારમાં પડયા કે સોય કઈ રીતે લઈ જવી. શેઠે વિચાર્યું કે હાથમાં પકડીને લઈ જવું પણ યાદ આવ્યું હાથ તો બળી જવાનો સોય તો અંહીયા જ રહેવાની પાછું વિચાર્યું કે ઝભ્ભાના કોલરમાં રાખી લઈ જવું પણ પાછું યાદ આવ્યું કે ઝભ્ભો પણ બળી જવાનો તેથી સોય પણ અહીંયા જ રહેવાની ત્યારે શેઠે તેની પુત્ર વધુને કહ્યું કે ટાંકણી કોઈ પણ રીતે લઈ જઈ શકાય. જ નહી. ત્યારે તેની પુત્ર વધુ

realpatidar.com

https://archive.org/details/bk109/page/n31/mode/1up

realpatidar.com

એ આવા મામી'ક શબ્દોથી સમજાવ્યું. કે કાંઈ સાથે નહીં આવે બધું જ અહી રહેવાનું છે.

આમ શેઠ સમજી ગયા કે હું ખોટો પૈસા પાછળ પડયો રહ્યો. દાન–પુન્યમાં, પૈસા વાપરયાં જ નથી. મૃત્યુ પછી ફક્ત પુન્ય જ સાથે આવે છે. ધન–દોલત સાથે આવતી નથી. એમ વિચાર કરીને શેઠ પસ્તાવો કરવા લાગ્યા. અને તે દિવસથી જ શેઠે બાકીની જિંદગીમાં સત કર્મોમાં સાથ આપવાનું નક્કી કર્યું આથી તેનો દિકરો અને વહુ ખુશ થયા.

ખરેખર એક સોય પણ સાથે આવશે નહીં તેમ શેઠ સમજ્યા. તેવી રીતે આપણે સમજવાની જરૂર છે. કે નહીં આવે કંઈ સાથે.

□

ભજન

માનવી શાને રે કરે તું આડાં અવળાં કામ (૨)
આ તો સપના જેવો સંસાર, આખર જાવું હરિ કેરા ધામ (૨)

આવ્યો ત્યારે દીધા કોલ હજાર, રડીને વારંવાર,
રાખ્યો તેથી વાલાએ વિશ્વાસ, ઝાલી ટચુકડો હાથ.
માનવી શાને રે કરે તું આડાં અવળાં કામ,

દિધી છે બુદ્ધિ, રિદ્ધિ ને સિદ્ધિ ભારે! ભાર
ન રાખી વાણીમાં મિઠાશ, ભૂલી દયાણુ તણી વાત....
માનવી શાને રે કરે તું આડાં અવળા કામ

દીધું છે હૈયું હરખિલ્લું–પ્રેમાળ કરવા ભજનનો ઉપાય,
ન દીધો આવકારો ત્યારે, આવ્યા દરિદ્રનારાયણ દ્વાર
માનવી શાને રે કરે તું આડાં અવળાં કામ

ભરી છે શક્તિ ને જેમ અપાર, દોડવા નિરાધાર પાસ,
ન કરી સેવા ત્યારે વિસારી શામળીયા ભણી સીખ.
માનવી શાને રે કરે તું આડાં અવળાં કામ

ચિતર્યા છે ચોપડા રોજમેળ તણા કાળા–ધોળા દિનરાત
છોડી કથીરનો સંગાથ, બાંધી લે પ્રિત પારસમણી સાથ
માનવી શાને રે કરે તું આડા અવળાં કામ,

આજ મારૂં હ્રદય રડે છે કાળજુ ફફડે છે કરતાં આડા–અવળાં કામ,
નાચે આનંદથી આતમ મારો, ગાતાં પ્રભુ તણો સુંદર ગાન.
માનવી શાને રે કરે તું આડા અવળાં કામ....

—પટેલ સુશીલાબેન મયુરકુમાર
ભવાનીપુરા [મોડાસા]

□

realpatidar.com

https://archive.org/details/bk109/page/n32/mode/1up

realpatidar.com

કુહાડાનો હાથો

–પટેલ મણીભાઈ કાનજીભાઈ
પાલડી લાટ, (અમદાવાદ)

એક મોટું જંગલ હતું. નાના મોટા વૃક્ષોથી ઘટા ટોપ જંગલ હતું. એ જંગલમાં હજારો વૃક્ષો હતા. લીલાછમ વૃક્ષો, જેતાં જ ગમી જાય તેવા એ વૃક્ષો જંગલમાં ઝુલી રહયા હતા.

એક્વાર એ જંગલમાં ઓચિંતો ખળભળાટ મચી ગયો. બન્યું એવું કે એક માણસ એ જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. એના ખભા ઉપર એક દોરડામાં પરોવેલો કુહાડો લટકતો હતો. એને જોઈ ને બધા વૃક્ષો કંપવા લાગ્યા. બિલાડીને જોઈને ઉંદર ધ્રુજે એમ આ વૃક્ષો ધ્રુજવા લાગ્યા. કેટલાક વૃક્ષોનાં પાંદડાં ખરવા લાગ્યાં. કેટલાંય વૃક્ષોના ફુલ ખરી પડયાં, તો વળી કેટલાકના તો ફળ ખરવા લાગ્યાં.

આ બધાં વૃક્ષોને આટલા બધાં ધ્રુજતાં જોઈને એક મોટું ઘેઘુર વડલાવૃક્ષનું કહેવા લાગ્યું કે હે ! વૃક્ષો તમે બધાં શા માટે ધ્રુજો છો ? આટલાં બધાં ડરી કેમ ગયાં છો ?

ત્યારે વૃક્ષો બોલ્યાં કે હે ! વડદાદા ! જુઓ તો ખરા પેલો માણસ કુહાડો લઈને આવે છે. તે હમણાં જ અમને મારશે. અમને કાપશે તેથી અમે ધ્રુજીએ છીએ. !!!

આ સાંભળીને વડ વૃક્ષોને કહે છે કે સહુ સાવધાન થઈને સાંભળો, તમે બધાં એ માણ-સથી ગભરાઓ છો પણ જુઓ એની પાસે કુહાડો છે, એને હાથો કયાં છે ? અને એનો હાથો બને શામાંથી ? બધા વૃક્ષો બોલ્યા કે એતો આપણામાંથી. બસ તો તમે યાદ રાખો કે એ હાથા વગર આપણને કાંઈ કરી શકવાનો નથી. જ્યાં સુધી આપણામાંથી કોઈ એનો હાથો નહિ થાય એને મદદ નહી થાય એને મદદ નહી કરે ત્યાં સુધી કોઈએ ગભરાવાની જરૂર નથી. જો આપણામાં કુસંપ હશે અને કોઈ આપણામાંથી જ એનો કુહાડાનો હાથો બનશે તો જ આપણને દુઃખ ભોગવ્વું પડશે. એ સિવાય ગભરાવવાની જરૂર નથી.

કેવી સુંદર વાત ! આ જગતમાં જે કાંઈ દુઃખ આવે છે એમાંથી કેટલાક તો જ્યારે પોતાના જ માણસો ફુટેલા હોય અને અંદરો અંદર કુસંપ હોય પછી અંદરના જ માણસ શત્રુને મદદ કરે છે. ત્યારે એ શત્રુનું બળ વધે અને એ આપણને દુઃખી કરે. એટલે જ કહેવત છે ને કે–ઘર ફુટે ઘર જાય.........

□

" સુવાકયો "

–નરસિંહભાઈ એમ. પટેલ
માઢવા તા. પ્રાંતિજ

(૧) " હસંતે હસ્તે કરેલા પાપો રોતે રોતે ભોગવવા પડે છે. "

(૨) " પ્રાર્થનામાં જોડેલા બે હાથ કરતાં દાન માટે લંબાવેલો એક હાથ વધુ કિંમતી છે. "

(૩) " માણસના કપડાં પર અનેક થીંગડા હશે તો ચાલશે પણ તેની શ્રદ્ધા ઉપર એક થીગડું પણ નહી ચાલે "

(૪) " લક્ષ્મી મહેનતથી આવતી નથી કંઈક લોકો મજુરી કરે છે પણ લક્ષ્મી મળતી નથી અને લક્ષ્મી બુદ્ધિથી પણ મળતી નથી. બુદ્ધિથી જો લક્ષ્મી મળતી હોય તો કંઈક પંડિતો પૈસાદાર થઈ ગયા હોત પણ લક્ષ્મી એક જ વસ્તુથી મળે છે અને તે છે 'પૂણ્ય' પૂણ્યથી જ લક્ષ્મી પ્રાપ્ત થાય છે. "

(૫) " પાપનો પૈસો તો પાપથી પણ વધુ ભયકંર છે, કારણ કે પાપ કરનારને જ નહિ પણ તેનાં છોકરાંને પણ કુબુદ્ધિનો દંશ દેશે. "

□

realpatidar.com

https://archive.org/details/bk109/page/n33/mode/1up

realpatidar.com

સાચા ભક્તનાં લક્ષણો

મનોજકુમાર ડી. પટેલ
દેસાઈપુરા–મોડાસા

સાચા ભક્તને ઈશ્વર પર અવિચલ શ્રદ્ધા હોય છે અડગ ગણાતો મેરૂ પર્વત કદાચ ક્યારેક ડગી જાય, પરંતુ ભક્તની ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા કદી ડગતી નથી જીવનમાં ગમે તેવી કપરી આપત્તિઓ આવી પડે તોયે તેનું મન ઈશ્વર પરની શ્રદ્ધામાંથી ચલિત થતું નથી સાચા ભક્તે પોતાનું સમગ્ર જીવન પ્રભુના ચરણે સમર્પિત કરી દીધું છે. આનંદના કે દુઃખના પ્રસંગોની તેમની મનોદશા પર કંઈ જ અસર થતી નથી તે દીવસ-રાત બધો જ સમય પ્રભુભક્તિના દિવ્ય આનંદમાં ડૂબેલા રહે છે સાચા ભક્તના જીવનમાં સત્સંગ અને સદ્ગુરુનું અનન્ય મહત્ત્વ હોય છે. અન્ય સાધકો તેમને ગુરુપદે સ્થાપે છે. અને તેમનો સંગ બીજા માટે સત્સંગ બની રહે છે. આમ છતાં તેમના મનમાં માન–અપમાનની ભાવના ઉદ્ભવતી નથી તેમણે અહંકારને ઓગાળી નાખ્યો છે સાંસારિક મોહમાયાની જાળથી તે મુક્ત થઇ ગયા છે. તેમના મનમાં કોઈ ઈચ્છાઓ કે તર્કવિતર્કો કદી ઉઠતા નથી. તે સાચો ભકત કહેવાય.

✻ ભજન ✻

પ્રેમિલા એન. પટેલ,
સિગ્નલકંપા–ખેડબ્રહ્મા

(રાગ : મુખડાની માયા લાગી)

સતસંગમાં નીત્ય રહીયે રે .... પ્રેમ તો કરીને
પ્રેમ તો પોતાનો જોઈએ વાદ કોઇનો ના લઇએ
ગુણ તો ગોવિન્દના ગાઈએ રે ....પ્રેમ તો કરી.
સતસંગમાં જઈ નહાવે, ગંગાથી અધિક કહાવે
મનના વિકાર જાવે રે ....પ્રેમ તો કરી.
સતસંગમાં લાભ ઘણો ધર્મ અર્થ કામ તણો
તે મુક્તિનું દ્વાર ભણો રે ....પ્રેમ તો કરી.
સતસંગ દુર્લભ ભાઈ પુન્ય વીના થાય નહી
અધમ નર ઉઠી જાય રે ....પ્રેમ તો કરી.
સતસંગમાં ભૂલ ભાગે સત્ શબ્દ બાણ વાગે
ત્યારે મનનો મોહ ત્યાગે રે ....પ્રેમ તો કરી.
સતસંગથી વિવેક આવે જ્ઞાન ને વૈરાગ આવે
વિષય વાસના ત્યારે જાવે રે ....પ્રેમ તો કરી.
સતસંગ ભાવથી કરી એ નિરંતર હરીને મલીયે
સહેજે ભવસાગર તરીયે રે ....પ્રેમ તો કરી.
ગુરૂ પ્રતાપે જોયુ જાગી, પ્રભુ સાથે પ્રિત લાગી
સંસારની ભાવટ ભાગી રે ....પ્રેમ તો કરી.

□

realpatidar.com

https://archive.org/details/bk109/page/n34/mode/1up

realpatidar.com

યુવા પેઢીને સમર્પિત

—રમેશકુમાર મોહનભાઈ પટેલ વેરાબર (ઇડર)

" જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત;
સમજાવ્યું તે પદ નમું; શ્રી સદ્ગુરૂ ભગવંત."

આપણી ભારતની ભૂમિ એટલે ઋષિઓ અને સંત-મહાત્માઓની પવિત્ર ભૂમિ જે ભૂમિ પર ભગવાનને પણ અવતાર લેવાનું મન થાય તે ભૂમિ. જે ભૂમિનું ઘરેણું વેદ-વિચાર-સામર્થ અને સતસંગનો સમન્વય સધાય છે; તે ભૂમિ એટલે આપણો ભારત દેશ, ભારત માતાની ભૂમિ, અને તેનાં આપણે સૌ સંતાનો પૂર્વ જનમમાં આપણે કોઈ સારાં ઉમદા કર્મો કરેલાં હશે. જેના ફલસ્વરૂપ આપણને આ દેશ અને ખાસ કરીને આવા સર્વગુણ સંપન્ન સમાજમાં જન્મ મળ્યો છે. તેથી દરેક ભારતીય " ઋષિ સંતાન " છે. જેનો પાવન અને પવિત્ર વિશિષ્ઠ વારસો આપણને મળ્યો છે. આ ભૂમિ પર અનેક સંતો, મહંતો, ઋષિઓ અને મહાત્માઓ થઈ ગયા. જે દરેક વંદનીય છે, આપણા સૌના આદરણીય છે.

આ યુગમાં....આ યુગમાં એટલે આજે જે સમય છે. તે અનુલક્ષીને, જ્યારે ધર્મવાદ, રાષ્ટ્રવાદ, સમાજવાદ, રાજકારણ વાદે ઊંડી ઘોર ખોદી છે. જ્યાં દષ્ટિ કરો ત્યાં વિરોધી વાતાવરણ આપણા સૌની નજર સમક્ષ જ છે, આવી આ કુદરતી અને નિર્વૈકલ્પિક સમસ્યાઓ ચારે કોર ફાગડોળે બેઠી છે. તે સમયમાં જ્યારે આ સનાતન સત્યને વળગી રહેલ સર્વે " સતપંથી " વડીલો, માતાઓ કે જેને અનેક સમસ્યાઓનો સામનો કરી પોતાની ભાવિ પેઢીને સાચા અથમાં જે ધર્મ છે તે " સતપંથ " પ્રથમ સાચા અર્થમાં પોતાના જીવનમાં ઉતારી સાચા સનાતન ધર્મ તરફ સાચો પંથ બતાવનાર એટલે આપણા સતપંથના પ્રણેતા સદ્ગુરુ શ્રી ઇમામશાહ મહારાજે આપણને અનુપમ ભેટ આપી જીવન ધન્ય ધન્ય બનાવડાવ્યું છે.

એવા આ યુગ પુરૂષે પોતાના જીવનકાળની આવરદામાં સમાજ અને રાષ્ટ્રના આધ્યાત્મિક જીવનનાં અને ભાવિ પેઢીઓ માટે પોતાના જીવનકાળની મર્યાદામાં એમને કેટકેટલું કરી બતાવ્યું. એમના જીવનમાં આપણને શ્રદ્ધા અને પ્રચંડ નૈતિક બળ અને આધ્યાત્મિક જાગૃતિની સમગ્ર સાધનાનાં દર્શન થાય છે. એક મનુષ્ય તરીકે તેમજ એક વેદાન્તિ તરીકે તેમને પુરૂષાર્થમાં જ ખરી પવિત્રતા જોઈ, અને પવિત્રતામાં જ ખરૂં પુરૂષાતન જોયું. એમની આધ્યાત્મિક અભિવ્યક્તિ તેમના ધર્મસંદેશમાંથી પ્રગટ થાય છે. તેમનું સમગ્ર જીવન અખંડ કર્મયોગ અને ધર્મ પ્રચાર માટે જ પરિપૂર્ણ હતું. દિવ્યજ્ઞાનથી પાવન થયેલ દ્રષ્ટિનું એ પરિણામ હતું. દૂરથી આવતા દૈવી આદેશો એમણે સાંભળ્યા, ઝીલ્યા અને ચોવીસે મુલકમાં સતપંથનો સંદેશો પહોંચાડયો અને જગત કલ્યાણના કાર્યો કર્યા.

આવા પુનીત આત્માએ આપણને તેત્રીસ કોટી દેવતાની પૂજા યજ્ઞ વિધિની મહિમાની અનુપમ ભેટ આપી છે. અને પૂજા યજ્ઞવિધિ પણ કેવી? ઘટપાટની આ પૂજાવિધિ વેદના આધારે જ છે.

દરેક પૂજા વિધિના મંત્રો તેત્રીસ કરોડ દેવોની હાજરીમાં અને એ પણ " ૐ " ના પવિત્ર ઉચ્ચારણથી દરેક મંત્રની શરૂઆત થાય છે. અને ચારે વેદ શ્રી બ્રહ્માજીના ચારે મુખમાંથી પ્રગટ થયેલ વાણી છે. તેથી આ વેદો અપૌરૂષેય છે. આપણી સંસ્કૃતિ અને ધર્મ તથા ઇતિહાસ

realpatidar.com

https://archive.org/details/bk109/page/n35/mode/1up

realpatidar.com

વિષે તો પશ્ચિમના દેશોને પણ અનોખું આકર્ષણ છે. ત્યાંના લેખકો અને ફિલોસોફરો જેવા કે માર્શમેન એલ્ફિન્સ્ટન વગેરે તત્વજ્ઞોએ ભારતીય ઇતિહાસ અંગેનાં પ્રમાણભૂત પુસ્તકોનો ખાસ અભ્યાસ કર્યો છે. જ્યારે આપણને ઉપરનાં કારણો જોતાં ઘેર બેઠા ગંગા છે. અને શ્રી ઈમામ-શાહ મહારાજશ્રીએ તો આપણને ગંગા ઘરમાં ઊતારી બતાવી છે અને તત્વ દર્શનની જિજ્ઞાસા ઉત્પન્ન કરી આપણને જીવનલક્ષી નવો રાહ બતાવ્યો છે.

ચેતવા જેવું છે :

આ કળિયુગ છે. આપણા મનુષ્ય દેહના આયુષ્યનો કોઈ ભરોસો નથી. આ દેહ ક્ષણભંગુર છે, જ્ઞાનીઓ તો કહે છે. દરેક સમયે ચેતવા જેવું છે, જાગ્રત થવા જેવું છે. " ભૂલ્યો ત્યાંથી ફરી ગણ, અને જાગ્યો ત્યાંથી સવાર. " આમ છતાં વૃત્તિ ચલિત થઈ જાય છે; ફરીફરીને જોવું શાના સામે ? આ સમયે સદ્‌ગુરૂએ કરેલ આજ્ઞા સામે દ્રષ્ટિ રાખીશું તો જરૂર સદ્‌માર્ગ મળશે.

❋ મને કોઈતો બતાવો ❋

વિનોદ એમ. પટેલ, પાલડીલાટ, અમદાવાદ.

ભજન

રાગ : હે મારી શેરીએથી કાનકુંવર આવતા રે લોલ
હે મને કોઈતો બતાવો નકળંક નાથને રે લોલ
ઘટ ઘટમાં રટું એના નામને રે લોલ...
મારા અંતરનો નાદ સુણી આવજો રે લોલ
પિરાણા ધામના નકળંક નાથજી રે લોલ...
હે, મારા નકળંક બિરાજે ધોળે ઘોડલે રે લોલ
ધોળી ધજા ધણીની ફરકે રે લોલ...
એવી જગમગતી તલવાર હાથમાં રે લોલ
ધુપના ધુમાડે દોડી આવતા રે લોલ...
મારા જનમો જનમની પ્રીતડી રે લોલ
નીદરું ના આવે સારી રાતડી રે લોલ...
એને પારે જો દુઃખીયા આવતા રે લોલ
દુઃખીયાને પ્રભુ સુખ આપતા રે લોલ...
એને પારે જો વાંઝિયા આવતાં રે લોલ
પારણીયે બાળ રૂડા ઝુલતા રે લોલ...
એવા દુઃખીઓના બેલી મારા નકળંક રે લોલ
સુણી પોકાર દોડી આવતા રે લોલ...
તારો સેવક ' વિનોદ ' સદા વિનવે રે લોલ
ભક્તોની લાજ સદા રાખજો રે લોલ...

□

realpatidar.com

https://archive.org/details/bk109/page/n36/mode/1up

realpatidar.com

* સંતોષ વિના તૃપ્તી નથી *

-પંકજ કે. ભીમાણી નાસિક M.S.

એક રાજા પાસે એક બકરો હતો, તેને લીલું ઘાસ બહુ ભાવતું હતું લીલું ઘાસ જૂએ કે ખાવા માટે દોડી જાય. રાજાને તે બકરો બહું પ્રીય હતો આથી રોજે તે તેને લીલું ઘાસ ખવડાવે. પરંતુ પેટ ભરીને ખાધા પછી પણ, જો તે બકરો લીલું ઘાસ જૂએ તો તે ખાવા માટે દોડી જાય. આથી રાજાએ વિચાર્યું મારે આ બકરાને, તે તૃપ્ત થાય ત્યા સુધી લીલું ઘાસ ખવરાવવું છે. આવું વિચારી રાજાએ ગામમાં ઢંઢેરો પીટાવ્યો કે જે કોઇ માણસ મારા બકરાને જંગલમાં લઈ જઇને તેને ચરાવીને તૃપ્ત કરી લાવશે તેને હું મારું અર્ધું રાજ્ય આપીશ. -

એક બકરાને ચરાવી લાવવો તેમાં શી મોટી ધાડ મારવાની છે એવું વિચારી એક માણસ રાજા પાસે ગયો અને બકરો લઇ ચરાવવા માટે જંગલમાં લઇ ગયો, નદી કીનારે લીલું ઘાસ હતું માણસે બકરાને તે ઘાસની વચમાં છોડી દીધો. બકરાએ ખુબ ઘાસ ખાધુ સાંજ પડી તે માણસને લાગ્યું કે હવે બકરો જરૂર ધરાઇ ગયો હશે, આથી બકરાને લઇ રાજા પાસે ગયો.

રાજાએ બકરા ઉપર પ્રેમથી હાથ ફેરવ્યો, પછી લીલું ઘાસ બકરા આગળ મૂક્યું. ઘાસ જોતા જ બકરો તે ખાવા લાગ્યો. આનું નામ તે વાસના. -વાસના એવી પ્રબળ છે કે તેની તૃપ્તી કદી થતી નથી.

અંતે એક પ્રભુ પરાયણ માણસ કે જે સ્વાનુભવથી ચંચળ મનને વશ કરવાનું જાણતો હતો તે રાજા પાસે ગયો અને બકરાને લઇને જંગલમાં ચરાવવા માટે લઇ ગયો.

જંગલમાં વિપુલ પ્રમાણમાં ઘાસ ઉગ્યું હતું ત્યાં બકરાને લઈ ગયો. બકરાને ઘાસ ખાવાની શરૂઆત કરી કે તરત માણસે પોતાની લાકડી બહુ જોરથી બકરાના મોઢા ઉપર ફટકારી આમ જ્યારે જ્યારે બકરો લીલું ઘાસ ખાવા જાય ત્યારે તે માણસ તેના મોઢા ઉપર જોરથી લાકડીનો ફટકો મારે.

બકરો સમજી ગયો લીલું ઘાસ ખાવાનો પ્રયાસ કરવો એટલે લાકડીનો ફટકો ખાવો. સાંજ પડતા પડતાં આ સત્ય બકરાને સમજાઇ ગયું. તેથી ઘાસ જોઇને મોઢું ફેરવવા લાગ્યો.

સાંજ પડી બકરાને લઇ માણસ મહેલમાં ગયો, રાજાએ હંમેશ પ્રમાણે લીલું ઘાસ બકરાની પાસે મૂક્યું. તે જોતાં જ બકરાએ મોઢું ફેરવી લીધું ઘાસને મોઢું ન લગાડ્યું. રાજાએ તે માણસને અર્ધું રાજ્ય આપ્યું. આમ તમારા મનરૂપી બકરો, કંઈ પણ માંગે ત્યારે તેને વિવેકરૂપી લાકડીથી ફટકારશો તો તે સુધરશે, નહીં તો વાસનાની તૃપ્તી કદી થતી નથી.

realpatidar.com

https://archive.org/details/bk109/page/n37/mode/1up

SATPANTH JYOT (MONTHLY) MAY-1995 Regd. No..........

realpatidar.com

From :-
સતપંથ જ્યોત
C/o. સતપંથ પ્રકાશન સમિતિ
પ્રેરણાપીઠ, પીરાણા, તા. દસક્રોઈ,
જિ. અમદાવાદ-382425.

To,

Printed-Book

Book-Post

ઈચ્છા.... થાય તો....

–કોમલ બી. પટેલ
બારસોલ-ખેડબ્રહ્મા.

સોબત કરવાની ઈચ્છા થાય તો–સજ્જનની કરો
જોવાની ઈચ્છા થાય તો–પોતાના દોષ જુવો
ગાવાની ઈચ્છા થાય તો–ગુણીજનોના ગુણ ગાવો.
કંઈક કરવાની ઇચ્છા થાય તો–બીજાનું ભલું કરો.
ભાંગવાની ઈચ્છા થાય તો–બીજાની ભીડ ભાંગો
લુંટવાની ઇચ્છા થાય તો–હરિરસ લૂંટો
નાશ કરવાની ઇચ્છા થાય તો–અધર્મનો નાશ કરો
ખાવાની ઇચ્છા થાય તો – ગમ ખાવો.
વાંચવાની ઈચ્છા થાય તો – સદ્ગ્રંથો વાંચો
પાલન કરવાની ઈચ્છા થાય તો – સત્યનું પાલન કરો.

□

ત્રણનો ચમત્કાર

–ભરત ડી. પટેલ
ભવાનીપુરા-મોડાસા.

ત્રણને માન આપો :–વડીલ, ન્યાય, સંયમ,
ત્રણ રાખવાં જોઈએ :–નમ્રતા, પ્રેમ, ધૈર્ય,
ત્રણના ગુણ ગાવ :–માતા, પિતા, ગુરૂ,
ત્રણની દૂર રહો :–દ્વેષ, અહમ, આડંબર,
ત્રણને દુશ્મન માનો:–ક્રોધ, વહેમ, કલેશ, ત્રણ
માટે પ્રાર્થના કરો :–શાંત, શ્રદ્ધા ચિત્તશુદ્ધિ,
ત્રણ માટે કજીયો ન કરો :–જર, જમીન, જોરૂ,
ત્રણ દુર્ગુણથી દૂર રહો:–ચોરી, વ્યાભચાર, નિંદા
ત્રણ માટે તૈયાર રહો :–દુઃખ, મૃત્યુ, વિપત્તિ,

□

realpatidar.com